

# આર્ધ્યાત્મક કુડી

તંત્રી : સરપાદક : કૈલાસઅહેન ઓન. પરીઅ



પરમ તેજવાની મા ગાયત્રી

# શ્રી ગાયત્રી ઇન્ડિયન ટ્રસ્ટ

## અમદાવાદ - ૧૬

[ ૧૭. નં. ૩૬૧ ]

ગાયત્રી ઉપાસક પૂજય શ્રી શાલ્વીલાઈ (નરેન્દ્રલાઈ બી. દવે) માર્ચ ૧૯૭૫થી ભા ગાયત્રીના આદેશથી લોકસેવાનો અલિગમ સ્વીકાર્યો છે. આધિ-વ્યાધિ-ઉપાધિથી નરત વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપી તેમના પ્રશ્નો સુલભાવવાનો પ્રયત્ન તેઓ વિના મૂલ્યે કરી રહ્યા છે. અસાધ્ય બિમારીથી વ્યથિત વ્યક્તિઓને પૂજયશ્રી ભા ગાયત્રીના આદેશ અને ભાગ્યર્દ્ધન અનુસાર શક્તિપ્રદાનની સારવાર આપી રોગમુક્ત કરવાનો પ્રયાસ કરે છે. અલિમંત્રિત જીવનજળ માનવીનું જીવન અનાવે છે અને જીવન અચાવે છે.

ભારતમાં અને વિદેશમાં પૂજયશ્રીની સેવાનો લાલ વિશાળ જનસમૃદ્ધાયે લીધો છે અને લઈ રહ્યા છે. ધાર્મનુગમાં જીવતી માનવીને આધ્યાત્મિક શરણુનો સીધો, સરળ રાહ અતાવા માનસિક શાંતિનો અનુભવ કરવે છે.

પૂજયશ્રીના આ અનોખા અને વિરલ કાર્યબરનો લાલ કોઈ પણ જ્ઞાતિ, જતિ, ધર્મ કે સમ્પ્રદાયના વિશાળ જનસમૃદ્ધાયને મળી શકે તેવા શુલ આશયથી પૂજયશ્રીની પ્રેરણું અને ભા ગાયત્રીના ઇપાથી શ્રી ગાયત્રી ઇન્ડિયન ટ્રસ્ટની સ્થાપના કરવાનો એક નાન્ય પ્રયાસ કર્યો છે.

આ ટ્રસ્ટના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે :

- (૧) ગરીબ તથા જરૂરવાળા માથુસોને દરેક પ્રકારે મદદ કરવી.
- (૨) કોઈ પણ પ્રકારના શિક્ષણુના ક્ષેત્રમાં મદદ કરવી.
- (૩) આધ્યાત્મિક સારવાર-કેન્દ્ર સ્થાપી અસાધ્ય બિમારીમાંથા લોકોને રાહત અપાવવી.
- (૪) કુદરતી આફિતમાં સપદાયેલાઓને સહાયદિપ થવું.
- (૫) વિશ્વબંધુત્વની લાવના ડેળવી માનવજીતને દરેક વિષમ પરિસ્થિતિમાં સહાયદિપ થવું.

અમારા આ નાન્ય પ્રયાસને આપ વધાવી લેશો અને વેગવંતો અનાવશો તેવા ના વિનંતિ.

આભાર સહ.

સરનામું :

કે. એન. પરીઅ

મેદનનો બંગલો, સીવીલ હોસ્પિટલ ફર્માઇન્ડ,  
અસારવા, અમદાવાદ-૧૬. (ગુજરાત) (ઇન્ડિયા)

કેન : ૬૭૬૬૭

કે. એન. પરીઅ

મેનેજિંગ ટ્રસ્ટી

શ્રી ગાયત્રી ઇન્ડિયન ટ્રસ્ટ



# આધ્યાત્મિક કેળી

૧૫૮ ૩

જાન્યુઆરી : ૧૯૮૪

૧૫૯ ૭

## અનુક્રમણિકા

|                                                                                                                                                                  |                                                                                       |                                |
|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|---------------------------------------------------------------------------------------|--------------------------------|
| ૧. તપશ્ચિ...<br>૨. શાતિની શાખ<br>૩. ...ને કબળો સારો થઈ ગયો<br>૪. પ્રાતઃકાળે બારણ્ણા ખખડાવનાર કોણ હતું ?<br>૫. પૂજ્ય ગુરુહેવના સાનિધ્યની પગોમાં ...<br>૬. શાનગોઢિ | શ્રી નરેન્દ્રલાલ ધી. દવે (શાસ્ત્રીણ) ...<br>નિરીશ શાહ ...<br>...<br>...<br>...<br>... | ૩<br>૫<br>૧૦<br>૧૧<br>૧૩<br>૧૮ |
| ૭. આત્મગુંજન : ૧<br>૮. આધ્યાત્મિક કેળી : પુરશ્વરણુના લીતરમાં ...<br>૯. પૈસા પાછા મળ્યા !<br>૧૦. કાષ્યપ્રસાદ<br>૧૧. સમાચાર                                        | ડૉ. કાન્તિલાલ કાલાણી<br>સતીશભાઈ લદુ<br>...<br>...                                     | ૨૦<br>૨૨<br>૨૪<br>૨૬<br>૨૭     |



નોંધ : ૧૯૮૪ના વર્ષનું લવાજમ રીન્યુ કરાવી લેવા વિનંતિ.

વાર્ષિક લવાજમ : રૂ. ૧૦

આ ટ્રેમાસિક અંક જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબર માસમાં પ્રગટ થશે.

પ્રકાશક : શ્રી કુલાસખેન એન. પરીખ, શ્રી ગાયત્રી ફાઉન્ડેશન ટ્રસ્ટ, મેટ્રન કવાર્ટ્સ,  
ન્યૂ સીનીલ હોરિઝન્ટ ક્રાફ્ટિંગ, અસારવા, અમદાવાદ-૩૮૦૦૧૬

સુધક : કાન્તિલાલ મ. ભિંબી, આહિય સુદ્રણ્ણાલય, રાયખડ, અમદાવાદ-૩૮૦૦૦૧

આધ્યાત્મિક કેડી  
જાન્યુઆરી : ૧૯૮૪



## તપશ્ચર્યા

શ્રી. નરેન્દ્રભાઈ બી. હવે (શાસ્ત્રીજ)

જીવનથી મૃત્યુપર્યંતના સમયના પટ પર માનવીની જીવનયાત્રા પ્રારમ્ભાય છે ને પરિપૂર્ણ થાય છે. તે જીવનયાત્રા દરમ્યાન ધીક્ષરીય તરવનો, પરમતત્ત્વના અસ્તિત્વનો સ્વીકાર કરીને, અથવા કરીએ તો તે તરફ માનવીએ ગતિ કરવાની રહે છે. એટલે એ એક પ્રથળ ને પ્રખર સાધના અની રહે છે, જીવન ને પરમતત્ત્વની સાધના. આ સાધનાને સિદ્ધ કરવા માટે તપશ્ચર્યા કરવી પડે છે. તપ વિના સિદ્ધ નથી એ ઉક્તિ આપણે સૌ જાણીએ છીએ.

ત્યારે પ્રશ્ન એ થાય કે તપશ્ચર્યા કરવી એટલે શું? પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ જંગલમાં જઈ તપ કરતા તે રીતે કોઈ પર્વત પર, કોઈ વૃક્ષ નીચે, કોઈ નદી-સરોવર કે સમુદ્રને કાંઠે વર્ષો સુધી પરમાત્માના ધ્યાનમાં એસી રહેવું ને જ્યો સુધી પરમતત્ત્વનો-પરમાત્માનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી ધેર પાછા ન કરવું એવો જ અર્થ થાય ને! આ એક અર્થ છે, ને સાચો છે. પણ તે, તે સમયના સંદર્ભમાં સાચો હતો એમ કઢી શકાય. આને સમય બદલાયો છે, ત્યારે તપશ્ચર્યાને વિશાળ અર્થમાં, સામૃત સમયના સંદર્ભમાં જોવા, સમજવા ને આચરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

પ્રાચીનકાળના ઋષિમુનિઓની જેમ પરમતત્ત્વને પામવાની તપશ્ચર્યા કરવાની છે, પણ એ તપશ્ચર્યા સામૃતકાળની પરિસ્થિતિ-જીવનપદ્ધતિને લક્ષ્યમાં રાખીને, સૌ સૌને અનુકૂળ-સરળ પડે તે રીતે, જંસારમાં રહીને જ, ગૃહત્યાગ કર્યા વિના પોતાના ધૃષ્ટની ઉપાસના કરવાની છે. પછી તે ઉપાસના દૈનિક અને ચોઝસ આયોજનપૂર્વકની હોય. એમાં ધૃષ્ટના મન્ત્રજ્યપ, સ્તુતિઓ, સ્તોત્રપઠન અને અન્ય પૂજા-અર્ચનાનો સમાવેશ થઈ શકે છે. પણ એમાં પણ શ્રદ્ધા, શરણ્યાગતિ, સમર્પણ ને શિશ્યભાવ જ પ્રધાનપણે હોવા જોઈએ. વિધિવિધાનને જૌથું બનાવવા જોઈએ એમ હું માતું છું.

પરન્તુ આટલું જ પૂરતું નથી. પરમતત્ત્વને પામવા માટે ખીજી ધર્થી આવશ્યકતાએ - સજ્જતા - સંભગતા હોવી જાઈએ, જેના પ્રતિ હું વાયકોનું ધ્યાન દોરવા માંગું છું.

'તપશ્ચર્યા' શાલ્દમાં એ શાણ્દો સમાયેલા છે. તપ: + અર્થાં. તપ એટલે ઉપર કહ્યું તેમ એનો વિશાળ અર્થ લઈએ તો સહન કરવું, ટેક રાખવી કે એક ધૈર્ય નક્કી કરવું તે. અર્થાં એટલે આચરણ કરવું, અમલમાં મૂકવું તે. જીવનમાં કેટલુંક સહન કરીને, એક ટેક, (નૈતિકતાની, ધીક્ષરને, આળખવાની, ઓળખીને ચાલવાની ને તેને પામવાની) એક ધૈર્ય નક્કી કરીને તેને આચરણમાં - અમલમાં મૂકુને જીવન જીવવું એવો એક વિશાળ સંદર્ભનો. અર્થ થઈ શકે, કરવો જોઈએ.

આમ જોઈએ તો માનવીનું સમય જીવન સ્વયં એક તપશ્ચર્યા જ છે. જીવનથી મૃત્યુપર્યંતના સમય સુધીમાં એણે કેટલું બધું સહન કરવાનું છે! તેણે એક ટેક ને ધૈર્ય નક્કી કરવાના - રાખવાના

આધ્યાત્મિક કેડી, જાન્યુઆરી, '૮૪ ]

હોય છે. અને એ તપશ્ચર્યા કરતો કરતો જ એણે જીવનને સમુજ્જીવલ, ઓર્ધ્વ ને ઉદ્ઘાત બનાવવાનું છે. જેમ ધૂપસળી પોતે બળને ભીજને - આસપાસના સમરસ વાતાવરણને સુવાસિત કરે છે, તેમ માનવીએ પણ પોતાના જીવનને સૌરભવન્તુ બનાવવાનું છે. કમળનું પુણ્ય કાહવની ગંધીને પોતાના પર ધારણું કરવા છતો પોતાના આનતરાભાવ સમરસ અરિતત્વની પવિત્રતાને જળવી રાખે છે, તે જ રીતે માનવીએ જીવનને પવિત્ર બનાવવાનું છે ને ત્યારે તે કમળની જેમ વિશિષ્ટ ને વિલક્ષણું માન-મોભો-ધંજાત-આખું-પ્રતિષ્ઠાનો અધિકારી બનશે. આ એક બહુ મોટી સાધના છે, તપશ્ચર્યા છે ને આપણે ધારીએ એટલી સરળ ને સહેલી નથી.

તપશ્ચર્યા શરીર, મન, વચન અને કર્મથી પવિત્ર રહેવા કરવામાં છે. તપશ્ચર્યાનો એક સામાન્ય અર્થ શરીરને કષ્ટ આપવું એવો પણ થાય છે. પણ શરીરને કષ્ટ આપવા કરતો શરીરનો એવી રીતે ઉપયોગ કરવો જોઈએ કે તપશ્ચર્યામાં તે સહાયર્થી બની શકે. શરીરભાવ ખલુ ધર્મસાધનમાં શરીર એ ધર્મનું એક સાધન છે. સાધના કરવા-તપશ્ચર્યા કરવા શરીરનો વિશેષ પ્રમાણું માં ઉપયોગ છે. પણ એ ઉપયોગ કેવી રીતે કરવો તે બરાબર સમજી લેવાની જરૂર છે.

કેટલાક તો ઉપવાસ કરવામાં, વારંવાર સ્નાન કરવામાં કે આલડહેટમાં જ અથથી ધર્તિ માને છે. અલખત ઉપવાસનો નિષેષ નથી ને સ્નાનશૌચાહિથી પવિત્ર થવાની પણ જરૂર તો છે જ, પણ એ તો એક અંશ માત્ર છે. ત્યાર પછી દૈનિક નિત્યક્રમ-મંત્રજ્ઞપ-પૂજાપાઠ વગેરે આવે છે ને એની સાથે રોજથરોજનો જીવનવ્યવહાર, ધર, નોકરી, સમજના કાર્યો નિત્યક્રમ પ્રમાણે ચાલે છે.

ઉપવાસનો અર્થ સ્વાદેન્દ્રિયને કાખૂંમાં રાખવાનો છે. તદુપરાંત દાર-માસ વજ્ય ગણ્યીએ. હિન્દુ ધર્મમાં એનો નિષેષ ગણ્યાયો છે. ત્યારથાદ હોટેલનાં ખાણી-પીણી ત્યાજ્ય ગણ્યીએ. પ્રત્યેક વાનગીએ ધેર બનાવીને કે બનાવડાવીને આઈએ. એમાં શુદ્ધ ને પવિત્રતા હોય છે. જ્યારે હોટેલનાં ખાણી-પીણીની શુદ્ધ-પવિત્રતા કેવા હોય ને કેવાં માણુસોને હાથે એ વાનગીએ રંધાતી હોય, પીરસતી હોય એવો તો સૌને અનુભવ હશે જ. અને તેવો ઓડકાર. એટલે એવું નિમ્ન કોટિનું બોજન જમવું તેના કરતો ધર્મા ધ્યાનનું રમરણું કરતાં કરતો રસોઈ બનાવીએ તો તે વધુ સ્વાદિષ્ટ ને પવિત્ર બનશે. આપણાં મન, બુદ્ધિ ને શરીરને સાત્ત્વિક રાખશે.

ઉપવાસ કરતો પણ મંત્રજ્ઞ, નામરભરણ, સ્તોત્રપઠન અને ધ્યાન પર લક્ષ્ય ડેન્દ્રિત કરવાની જરૂર છે. મંત્રાચારના શર્ષ્ટદોના આંદોલનો સમગ્ર શરીરમાં વ્યાપોને વ્યક્તિને દિવ્યશક્તિસંપત્ત બનાવે છે તેમ જ દિવ્ય ને અલૌદિક અનુભવો કરાવે છે. એ તો સ્વાનુભવે જ સમજશે. મંત્રાચારના એ અદ્યાત્મનો માનવીના આનતરાભાવ સમગ્ર અરિતત્વને પવિત્ર ને સાત્ત્વિક બનાવે છે, ને જીવનની તપશ્ચર્યા કરવા માટે ધાર્થ જરૂરી છે.

શરીરની તપશ્ચર્યામાં પ્રત્યેક ધન્દિયોનો પણ સમાવેશ થાય છે. એ ધન્દિયોનો સંબંધિત ને વધાયોગ્ય વિનિયોગ પરમતરસ્વની નજીક લઈ જવા માટે બહુ મોટો ભાગ અજવી રહેશે.

શરીરમાં આખ અગત્યનું અંગ છે. તે જોવાનું કાર્ય કરે છે. આખને હંમેશ શિષ્ટતાના-ભદ્રતાના દર્શાન તરફ વાળોએ. ધર્શરીરના, ધર્શરીરિય ઔર્ધ્વર્થના દર્શાનમાં રોકી રાખીએ. આ સૃષ્ટિના પ્રત્યેક જરૂર-ચેતન તત્ત્વમાં ધર્શરીરિય ઔર્ધ્વર્થ-સૌન્દર્ય વેરાયેલું પડેલું છે. તેને નિદ્ધાળતો આનંદ આવે છે, એક પ્રતીતિ થાય છે ધર્શરીરિયતાની ને એમાથી પ્રાપ્ત થાય છે એક નૂતન પ્રેરણ્યા, એક નવીન સન્દેશ, એક નવું જ બળ-આત્મબળ ને પછી સમજાય છે આ શરીર, જીવન ને સંસારની ક્ષાણકાળ ગુરતા ને ધર્શરીરિય સુખ

—ઐખર્યાની શાખાના. આ સહિતો જડ-ચેન પ્રત્યેક પદ્ધતિ માનવીને કંઈક ને કંઈક સદ્ગયઃપ ને પ્રેરણ બની રહે છે. આપણું એક દષ્ટિ કરીએ આકાશ તરફ, આકાશમાં જાગતા સર્વ તરફ, ચન્દ્ર તરફ, તારા તરફ, કલકલ વહેતાં નથી, સરોવર ને સમુદ્ર તરફ, નિત્ય પોતાની છાયા ફેલાવતા ગૃહો તરફ, સુવાસિત ને પ્રકૃતિલિંગ બનીને કરમાઈને ખરી પડતા પુષ્પો તરફ, સૈકાઓથી અડીખમ જિભા રહેવાનું જાણું વત ધારણ કરી એકેલા પર્વતો તરફ ને એમાથી તપશ્ચર્યાનો, પરોપકારિતાનો, સહનશીલતાનો, ઝજુતાનો, પંવિતતાનો ને પરમતરત્વના અરિતત્વના આવિજ્ઞારનો. એક વિરલ સંદેશ પ્રાપ્ત થાય છે. પ્રભુના ઐખર્યાને નિહાળતાં, તેના દર્શનની સાથે જ સર્વ સુજો તુચ્છ, ક્ષણિક ને નિરથીં લાગે છે.

પણ, આજે આપણું દષ્ટિ ડેવળ કુલ્લકતા તરફ અલદ-અશિષ્ટ તરફ જ જાય છે. આજના આપણું ધણા ખરી સામયિકો, કેટલુંક અશિષ્ટ-અશ્વલીલ સાહિલ ને સિનેમાઓ જોવામાં જ આપણુંને રસ પડે છે, જે આપણું યુવાપેઢીને ગેરમાર્ગ હોયે છે, તેની વૃત્તિઓને બહેકાવે છે, પ્રવૃત્તિઓને દીન ને કુલ્લક બનાવે છે. યુવાનો એ તરફ વળે છે, વહીલો તેમને ત્યાથી વારવાનો પ્રયત્ન કરે છે ને ત્યાથી યુવા પેઢી ને વહીલો વચ્ચેનો સંધર્ય શરૂ થાય છે.

જ્યાં સુધી આપણું આત્મ-બાધ્ય ચક્ષુઓ શિષ્ટ-અશિષ્ટ, લદ-અલદ, શ્રેય-અશ્રેય, પ્રેય-અપ્રેયનો વિવેક ન કરી શકશો, ત્યાં સુધી આપણું કોઈ સિદ્ધિ મેળવી નહીં શકાયે.

કાનને હંમેશ શુભ અને લદ વાતો સાંભળવામાં જ રોકી રાખ્યાયે. કોઈની દીકા-નિન્દા ન સંભળાય તેનું ધ્યાન રાખ્યાયે. કથા-પ્રવચનો-પ્રભુની વાતો સાંભળવામાં કાનને રોકેલા રાખ્યાયે. એમાથી જીવનો એક માર્ગ મળો જશે ને આગળ વધી શકશો.

હાથ ને પગને સત્કર્મ પ્રતિ વાળાયે. ડેવળ પ્રભુદ્વાને જવાથી કે દાન કરવાથી કોઈ વળતું નથી. દાન કરીએ તો નિષ્કામ કરીયે. તેની જહેરાત ન થાય, તેનું ધ્યાન રાખ્યાયે. મન્દિરમાં પ્રભુદ્વાનની સાથે એટલું પણ યાદ રાખ્યાયે કે પ્રત્યેક માનવીના હૃદયમાં પ્રભુ બિરાનેદો છે. આત્મા એ જ પરમાત્મા છે. કોઈ પણ દુઃખી ભાષ્યસના દ્વિલને દ્વિલસે આપવો કે તેને મદદ કરવી તે પ્રભુને પ્રસન્ન કર્યા બરાબર છે. તે પ્રભુનું કાર્ય છે. મન્દિરમાં દર્શાન કરવા એ પ્રભુભક્તિની ધતિશી નથી. પ્રભુ તો સર્વત્ર ને સર્વબ્યાપક છે. એનો અનુભવ કરીયે. ઈશ્વરીય રમરણુનો લય તો અહિનીશ ચાલુ રહેવો જોઈએ. પ્રભુ માટે પ્રેમ ને લગતીની જ્યોત સદ્ગતી રહેવી જોઈએ. તો જ ઈશ્વરની સમીપ જલ્દીથી પહોંચ શકશો અને આ સંસારની ભાયામાથી સુક્ત થઈ શકશો.

બાધ્ય સુખોમાં, કુલ્લકતામાં ભમતી-અટવાતી ઈન્દ્રિયોને આનતરમુખી અનાવી પ્રભુના નામરમરણુમાં બને એટલી રત રાખી જીવને રચનાત્મક માર્ગ વાળીએ તો એમાથી એક અવર્ણનીય ને અલૌકિક આનંદ પ્રાપ્ત થાય છે. ઈશ્વરની કૃપાના પણ અનેક અનુભવો થાય છે.

આપણું, આપણું જીવન ને સંસારને પ્રિય-અપ્રિય કટુ-મધુર અનાવવામાં, આપણું તપશ્ચર્યા કરવામાં કે તેમાં વિક્ષેપ જિભો કરવામાં વાણી પણ બહુ જ મોટો ભાગ ભરવે છે. વાણીને સંયમિત કરવાની, જલને કાખૂમાં રાખવાની અનેક સન્તોષ-દ્વિલસુદ્ધાયે વાત કરી છે ને એ ધણું દુઃકર છે. પરંતુ મને એનો એક અતિ સરળ ઉપાય સૂચે છે ને તે નામરમરણ ને પ્રાર્થના. તમે હંમેશ સવારમાં જિઠાની સાથે ને રાત્રે પથારીમાં સૂતા ઈષ્ટતું રમરણ કરી, જ્ય કરી, પ્રભુને પ્રાર્થના કરો કે હે પ્રભુ, મારી વાણીને સંયમિત કરજો. મારી વાણીમાથી હંદી કોઈને દુઃખકર, અપ્રિય હાનિકર્તા શખ્ફો ન નીકળો. મારી વાણીમાથી નીકળતા પ્રત્યેક શખ્ફો પર તારી આણું પ્રવર્તી રહેનો. મારી વાણીની લગામ

તારા હાથમાં દેખેશને માટે રાખજો તે તારા ગુણગાન ગાયા, તારી બક્સિ કરવા એમાં આખૂટ બક્સિ ગુજરાને, મને લાગે છે કે આટલું કરવાથી જરૂર આપણી વાણી મધુર ને પ્રિય અનથે.

ડાઈને એમ પણ ચાય કે, જોલવાનું એટલે જોલવાનું, અમને ફૂલે તેમ જોલીઓ, ડાઈને જાદું લાગે કે દુઃખ ચાય તેમાં એમે શું કરીએ વળી ? ને જોલવા માટે ચાણી પ્રાર્થના કરવાની. આ તો અદું કહેવાયા?

હા, જોલવા માટે પ્રાર્થના કરવાની. આ શરીર એ કેવળ પરમાત્માનું સર્જન છે, પરમાત્માનો આવાસ છે, એટલે બહુ જ સુદૂર રીતે વિચારીએ તો માનવીના શરીર, કુલ ને સર્વસાર સમસ્ત પર પ્રભુની આણું પ્રવર્તે છે, પણ આપણે એ આણું પ્રત્યે સંનગ નથી, તેથી સંનગ થવાની, એની આણુના પ્રવર્તનનો રૂપીકાર કરવાની જરૂર છે. કે શરીરમાં પરમાત્મા એઠો છે, ત્વાથી દર્મેશ શુલ્ક શાખાને જ નીછળવા ધરે, ને માનવીએ સત્યાં એટલી દુઃખુંથી પ્રયત્ન કરવો જોઈએ કે એ વાણી ‘પ્રભુવાણી’ બની શકે। આ ઘણી જ કપરી ને ડાઈન તપશ્ચર્યા છે. માનવીની વાણી ને પ્રભુની વાણી બની જાય તો પછી એને માટે કશું જ દુઃખર નથી રહેતું.

આ સાથે જ બીજુ વાત ચાદ આવે છે કે, સત્ય વહુ, પ્રિય વહુ, સત્ય જોલવું જોઈએ, પ્રિય જોલવું જોઈએ. સત્ય છતાં કંદુ વચ્ચેન કચારેય ન ઉચ્ચારવા એ સિદ્ધાત મનુષ્યે ચાદ રાખવા જેવો છે. એ જ રીતે We have to creat the way to talk with anybody and to say something to anybody. દરેકની સાથે વાત કરવાનો કે કશું પણ કહેવાનો એક તરીકે સૌએ અપનાવવો જોઈએ. ડાઈપણ વાતની રજૂઆત એવી રીતે કરીએ કે તે સામા ભાષુસના બળે જિતરે. તેનું માન જળવાય. તેની ભૂલ હોય તો માદું ન લાગે. સત્ય દ્વારા સમજાય. આ તરીકો જીવનના ડાઈપણ ક્ષેત્રે, ડાઈપણ વ્યવહારમાં બહુ જ ઉપયોગી થઈ પડશે.

એનું જ વર્તનનું છે. પ્રત્યેક સાથેનું વર્તન સહભાવ ને સમભાવપૂર્ણ, પૂર્વભદ્ર-અભિભદ્ધયુક્તા, ધ્યાન, દ્વૈપ વિનાનું હોનું જોઈએ. આપણા વર્તનથી કદી ડાઈને દુઃખ કે દાનિન પહોંચે તેની કાળજી રાખીએ. આપણા સારા-ઝોટા વર્તનનો એક ૨૪ માત્ર જોટલો પણ અંશ સામા ભાષુસના મનને નિરાશા-હતાશ કરીને ભાગી નાખે છે કે, પછી પ્રસન્ન કરી હે છે ને તેનાં દુઃખ, જ્વાનિ, નિરાશા, હતાશને વિદારી હે છે, આશા, ઉત્સાહનું એક નવું જ કિરણું પ્રસરાવી રહે છે તે ભૂલવું જોઈએ નહિ.

પણ, એનો બધો જ આધાર માનવીના મનોબ્યાપાર ઉપર રહેલો છે. માનવીનું મન અતિ ગૂઢ, અદું ને અગમ્ય છે. એની લીલાનો પાર પામી શકાય તેમ નથી. મનને વિશે એનેક દ્વિલસ્ફેરાએ ઘણી ઘણી વાતો કરી છે, તેમ છતાં એનો તાગ પામી શકાતો નથી. માનવીએ મનને સ્વર્થ રાખવાનું છે. મનને સ્વર્થ રાખવાની પણ એક આકરી ને દુઃખર એવી પ્રક્રિયા છે - તપશ્ચર્યા છે. જેએ મનને પોતાના નિયંત્રણમાં લઈ શકે છે, તેએ સિદ્ધાવરથાની એક સર્વોચ્ચ ડાટિએ પહોંચી જાય છે. પછી તેને ઔતિકિ-આધ્યાત્મિક સર્વ વાતો સિદ્ધ ને સરળ બની જાય છે. પણ એ ડાટિએ એમ એટલી સહેલાઈથી પહોંચી શકતું નથી. એને માટે પ્રયત્ન કરવો પડે.

મનને વશ કરવા ઈશ્વરનું-ઇશ્વરનું નામરમરણ અમેધ ઉપાય છે. મનને દર્મેશ સહવિચારો ને ઈશ્વરીય રમરણથી ભરી રાખીએ. મનને સતત કાર્ય શીલ રાખીએ. ઉચ્ચ ડાટિના સાદિતિક-આધ્યાત્મિક-ઇશ્વરવિપયક વાચનમાં પરોવાયેલું રાખીએ. કુદરતી વાતાવરણમાં ઇરવાનું રાખીએ. સત્સંગ કરીએ

અથવા અન્ય શોભના-રસના વિષયના અધ્યયનમાં, લેખન-વાચનમાં મનને રોકેલું રાખ્યાઓ. આથી પ્રત્યેક અતુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઉપકારક નીવડી શકશે. એથી માનસિક શાંતિ પણ મળશે.

આ બધું ઈશ્વરને ખાતર - for the sake of God - કરવાનું છે. આથી સમરસ અરિતત્વમાથી વિકારા-હૃર્ષિતિઓનો નાશ થશે. ઈશ્વરીયતાને અલિમુખ બની, કંમશા: તેની સમીપ જર્દ શકશે.

અણીં કદાચ ડોઈને પ્રશ્ન થાય કે શું આટલા ભાત્રથી જ ઈશ્વરની પ્રાપ્તિ થઈ જશે કે થઈ શકશે? હા, થઈ શકે. At least-કંમસે કંમ તેની કૃપાની અનેકવિધ અતુકૂળતિઓ તો થશે જ. તમે વળી પાણી કદાચ કહેશો કે, એટલાથી શું? તમે તો કહ્યું છે કે, પરમતત્વને પામવા, પ્રલુનો સાક્ષાત્કાર કરવા તપશ્ચર્યા કરવાની છે. એથી ઈશ્વર મળશે. એટલે અમારે તો ભગવાન મેળવવા છે. હા, પણ અણીં પાણી કર્મની ફિલસ્ફ્ઝી યાદ કરવાની છે. મેં ધણીવાર કહ્યું છે કે, પૂર્વ લવની ભક્તિનું જમા પાસું હશે, ત્યારી આ લવે આગળ વધવાનું છે, એટલે ભક્તિની ધ્યત્વા મનુષ્યે મનુષ્યે બિન બિન હોવાની. મનુષ્યે મનુષ્યે ઈશ્વરીય માન્યતાઓ, ઈશ્વરીય કર્મ-ભક્તિનું આચરણ વિલિન રવિપે ચરિતાર્થ થતું જેવા મળે છે.

આપણું શરીર પર આવતા અનેકવિધ નાના મોટા વ્યાધિઓ આપણું જ કર્મનું ઇન છે. તે બોગવં પડે છે, રોગોની વેદના સહન કરવી પડે છે અને એ ઇન બોગવાની ને આખી પ્રક્રિયા છે, તે એક તપશ્ચર્યા જ છે. આપણે ધણી વાર જેઠીએ છીએ કે, આધુનિક તખીઓ સવલતો ને સારવાર દેવા છત૊ ધણું રોગ-ધીમારીઓ કાયૂમાં નથી આવતો, પણ જ્યાં વ્યક્તિએ ઈષ્ટની શરણુાગતિ સ્વીકારી, શ્રદ્ધાપૂર્વક રમરણ આદ્યું ત્યાં જ એ રોગ-ધીમારી કાયૂમાં આવે છે, રાહત કે મુક્તિ મળે છે. આ એક આધ્યાત્મિક સત્ય છે, કર્મની ગતિની ગઢનતા છે. અને તપશ્ચર્યા એનું ઉદ્ઘારક બળ બની રહે છે.

જીવનની આ સમય તપશ્ચર્યાને આટે પણ શ્રદ્ધા અને શરણુાગતિ પ્રથમ આવશ્યક છે. ઈશ્વરમાં જેટલી શ્રદ્ધા હશે, જેવી ને જેટલી એની શરણુાગતિ સ્વીકારી હશે, વ્યક્તિને પોતાની જાતમાં જેટલો વિશ્વાસ હશે, વ્યક્તિ જાત ને જીવન પ્રત્યે જેટલી સંજગ હશે કે રહેશે તેટલી આ અતિ હૃષ્ટ તપશ્ચર્યા યોડીક સરળ બનશે ને જીવનને જીર્ખ, ઉંનત, ઉદ્ઘાત બનાવી, આત્માનો વિશ્વાસ કરી ઈશ્વરની સમીપ લરાથી લઈ જર્દ શકશે.



મા ગાયત્રીની કૃપા

શ્રી ગણેશ ટ્રેડસ್

‘ભગવતી’



ઉદ્વાડા-R.s. ૩૬૬૧૮૫

આધ્યાત્મિક ડેડી, જન્મયુઆરી, '૮૪ |

## શર્મિંતિલી શાંધ,

**પુનઃ** જથું ગુરુહેવની પાસે વ્યક્તિગત મુલાકાત અને ભાર્ગવશાંન માટે આવતી વ્યક્તિઓમાં મોઢા ભાગની વ્યક્તિઓને માનસિક તણુવાન હોય છે. ચોમેર અશાંતિ વર્તાય છે. અંધકાર ભાસે છે. જીવન જીવનું અસ્થિ થઈ પડે છે. ધણું કહે છે, આ સંસાર છોડી દેવો છે. હિમાલયમાં જર્ઝ શાંતિ મેળવવી છે. ધણું જીવનદીપ જુઝાવી દેવાના નિર્ણય પર આવી જાય છે.

થોડા વખત પહેલાં એક ભાઈ ગુરુહેવ પાસે મુલાકાત માટે આવ્યા. અતિશય લગ્ન હદ્દે હદ્દે, “ગુરુહેવ, છેલ્લા કેટલાક મહિનાથી રાતે નિરાંતે જાંધ આવતી નથી. ચિંતાથી મારું મગજ અર્ધ પાગલ થઈ ગયું છે. માનસિક અશાંતિ એટલી અધી વધી ગઈ છે કે હવે જીવન જીવનું દુષ્કર લાગે છે. કોઈ જીવનનો અંત લાવી દ્વારા કે કાં તો સંસાર છોડી હરદાર કે હિમાલયમાં જર્ઝને શાંતિનો શાસ લડાયા.

ગુરુહેવ ભારે શાંતિ જોઈએ છે ! નિરાંતે જાંધી શકું અને ચિંતાઓથી મુક્ત થડં એવું કંઈક કરો.”

ગુરુહેવ કહ્યું, “તમને હરદાર કે હિમાલય જવાથી માનસિક શાંતિ મળશે જ એની શું ખાતરી ? આઠલી નાની ઉંમરમાં જવાખારી અદા કરવાની તો હજુ બાકી છે. તમે તમારા કાર્યક્ષેત્રમાથી કેવી રીત ભાગી જર્ઝ શકો ?”

ગુરુહેવ તેની ચિંતાઓને વહાવવા માટે તેને પાસે એસાડી વાતસલ્યપૂર્ણ સહદ્યતાથી તેની વાત વિગતે સાંભળી. તેને થોડા રડવા દીધો, પછી વાતસલ્યપૂર્ણ મૃદુ હસ્ત બરડે પસવારતા હદ્દું, “તમારી અધી ચિંતાઓ મને સોચી હો. અને તમે ઇકા સંપૂર્ણ શક્તા અને શરણુગતિથી ગાયત્રી મહામંત્રની ત્રણ માળાનો નિત્યક્રમ અપનાવો. જીવનજળનું સેવન કરનો. અને એક મહિના પછી મને મળજો.”

ચિંતાની ચુંગાલમાથી ઘૂંઠવા માટે છષ્ટ રમરણ, મંત્રનાપ કે પ્રાર્થના એક ઉત્તમ ઔપદ્ધતિ છે. થોડ્ય રીતે સંપૂર્ણ શક્તા અને શરણુગતિથી કરવામાં આવેલી પ્રાર્થના ગમે તે પ્રશ્ન ઉકેલી શકે છે. પ્રશ્ન પ્રાર્થનાનો અનુભવ માણુલા જેવો છે. જીવનના સર્વ સુખ અને વૈલબોની ચાવીઓ એમાં રહેલી છે.

સ્વામી રામતીર્થ એક સુંદર રરતો બતાવે છે. તેઓ કહે છે કે “સર્વ કુછ છોડકર પરમાત્માજી નામ લો. ઉનકો અપના કામ કરને હો.”

એક મહિના પછી એ ભાઈ ફરીથી ગુરુહેવને મળવા આવ્યા ત્યારે ધણું સ્વરસ્થ હતા. તેમની ચિંતાનો એજ હળવો થઈ ગયો હતો. માનસિક શાંતિનો અનુભવ થયો હતો. અને રાતે નિરાંતે જાંધી શકતા હતા.

ગુરુહેવ વાતસલ્યપૂર્ણ મૃદુ હાસ્ય સાથે ભાઈને આવકાર્યા. ગુરુહેવની ચરણવંદના કરતા ભાઈ અતિ ગુણગુણ કરું આભારની લાગણી સાથે એલ્યા, “ગુરુહેવ, આપની સહદ્યતાએ મને બચાવી દીધો. આપે મને જાતિનો રાહ સુઝાડ્યો છે. ગાયત્રી મંત્રનાપથી મને ખરેખર માનસિક શાંતિ મળે છે. જીવનજળો મારું જીવન બનાયું છે, મારું જીવન બચાયું છે.”

શુદ્ધેવે માર્ભિક અને અર્થસબર વાણીમાં કહ્યું, "તુરદાર અને ડિમાલય એવું જ અદી છે. આપણી અંદર જ હોય છે, આપણે એક સંપૂર્ણ એકમ છીએ, વર્તુળ છીએ."

ભૂમિતિમાં જેવી રીતે વર્તુળનું ફેન્ડ વર્તુળની અંદર જ હોય, તેવી રીતે આપણું ફેન્ડ આપણી અંદર જ છે. નિયમ ભૂમિતિનો હોય, જીવનના ગણ્યિતનો હોય કે અધ્યાત્મનો, એક સરળી રીતે એ કામ કરતા હોય છે.

આપણે આપણા સ્વરૂપને એણખબું જોઈએ, શુદ્ધ અને સત્ત્વને પીછાચુવા જોઈએ. આપણી જાતને કદી પણ આપણી નજરમાંથી નીચી ઉત્તરવા દેવી નહિ. જેવા છીએ તેવા જ આપણે આપણી જાતને સ્વીકારીએ. અશક્ય આદર્શીની પાછળ હોડીએ નહિ. આપણું સત્ત્વ જે આપણુને સમજશે તો તે આપણું ખળ બની રહેશે. આપણે પ્રશાન્ત બનીએ અને ખોટા ભર્મો અને અસ્ત્રોને રૂગોણી દઈએ. અશીતી છીકાત લાગતી હોવા છતો તે વિનિષ્ઠ થઈ શકે છે. પરમ શાતી આપણુને આપણામાથી જ મળા રહેશે.



\*\*\*\*\*

મા ગાયત્રીની કૃપા અને પુ. શાસ્ત્રીજીના આશિષ અમ સૌ  
પર અવિરતપણે વરસતા રહો એવી અસ્થર્થના સહિત.

## NARENDR A PROCESSING INDUSTRIES

Tele. : Factory : 34066, 34067 \* Resi. : C/o 24889



3-1, Plot No. 1, Behind Sub-Jail, Khatodra,  
SURAT - 395 002

\*\*\*\*\*

અધ્યાત્મિક ફેરી, જાન્યુઆરી, '૮૪ ]

## ....ને કમળો સારો થઈ ગયો !

‘સંદેશ’માં આવતા પુ. શુરુદેવના ‘અગોચર મનની અજયણી’ના લેખાભાધી મને ગાયત્રી-મન્ત્રની માળા કરવાની પ્રેરણું મળો હતી. તેથી લગભગ વરસ-હોઠ વર્ષથી મારો માળા કરવાનો નિત્યક્રમ ચાલુ જ હતો. લગભગ એ સમયના ગાળામાં મા ગાયત્રીએ અમારા કુટુમ્બ પર અસીમ કૃપા વરસાવી હતી, તે સવિસતર જણાવું છું.

તારીખ તો મને યાદ નથી પરન્તુ ૧૯૭૮ ની સાલ હતી. જન્માષ્ટમીના ખીજ દિવસે મારા પિતાશ્રીને કમળાના રોગને લીધે અમદાવાહની સિવિલ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. હોસ્પિટલમાં બે-તણું દિવસમાં કમળાનું પ્રમાણું વધી ગયું હતું. લોહીમાં તેનું પ્રમાણું લગભગ ઉર ટકા જોટલું હતું. પિતાજી ખૂબ જ પીડાતા હતા. પેટનો દુઃખાવો અસંખ્ય હતો. રાત-દિવસના સૌને ઉલગરા થતા હતા. ડોક્ટરે મને કહ્યું કે, ‘તમારા પિતાશ્રીનું લીવર ઉમેજ થઈ ગયું છે. લીવર કામ કરતું નથી. લીવર કામ કરતું થાય તો જ બચવાની આશા રાખી શકાય, નહીં તો ડેસ સીરીયસ કહેવાય.’ ડોક્ટરનું આ કથન સાંભળી મારા પગ તો પાણી પાણી થઈ ગયા હતા. શરીરમાં થોડી દુંગરી પણ આવી નથી. શું કરવું તેની સમજ નહોંતી પડતી. મારા પિતાશ્રીના પલંગ પાસે મા ગાયત્રીની છથી મૂકી રાખી હતી. તે છથી પર મારું ધ્યાન કેન્દ્રિત થયું. માતાજીને મેં મને માન પ્રાર્થના કરી. તે દિવસે રાત્રે માતાજીએ મને શાખીજીને ત્રણ જવાની પ્રેરણું આપી. હું તેમને ત્રણ ગયો. શાખીજીના મેં પહેલી જ વાર દર્શાન કર્યાં. બહારથી જળ ભરીને હું તેમના ઓરડામાં દાખલ થયો. તેમણે ખૂબ જ પ્રેમથી મને આવવાનું કારણ પૂછ્યું. ડોક્ટરે કહેલી વાત તેમને કહેતાં હું રડી પડ્યો.

શાખીજીએ મને હૈયાધારથું આપતા કહ્યું કે, ‘ચિન્તા કરશો નહિ. માતાજી સારું કરી હેશે.’ ત્યારથાદ જીવનજળ આપતા જણાવ્યું કે ‘આ જળ સિવાય ખીજું’ જળ આપશો નહિ. દ્વા-ગોળા પણ આ જળ સાથે જ આપવી !’ તેમને પ્રણામ કરી હું હોસ્પિટલ ગયો, અને જીવનજળ આપવાનું શરૂ કર્યું. જળ આપતાં જ પેટનો દુઃખાવો ગાયથ થઈ ગયો. થોડી રાહત અનુભવી. સાંજે પાંચ વાગ્યા સુધી જીવનજળ ચાલ્યું, ત્યાર પછી જળ ખલાસ થઈ ગયું. દુઃખાવો ક્રી ચાલુ થયો. ખીજે દિવસે પાંચ લીટરનો શીશો લઈને શાખીજ પાસે ગયો. પહેલાં તો મોટો શીશો જોઈને તેઓ હસી પડ્યા. મેં તેમને વીગત જણાવી. ત્યારથાદ જીવનજળ આપતા મને જણાવ્યું કે ‘ડોક્ટર રન્ન આપે તો તુલસીના નવ પાન આ જળ સાથે આપશો. ....’

ધીમે ધીમે કમળો એણો થતો ગયો. ચારથી પાંચ દિવસમાં કમળાનું પ્રમાણું એક ટકા જોટલું જ રહ્યું. ડોક્ટરે આવાની પણ ધૂટ આપી દીધી હતી. કારણ કે લીવરમાં સાધારણ સુધારા થયો હતો.

આમ માતાજીની કૃપા તથા પુ. શાખીજીના આશીર્વાદથી મારા પિતાશ્રી મોતના સુખમાથી બચી ગયા હતા. લારપછી હું પુ. શાખીજીનો સેવક બની ગયો છું.

— ગિરીશ શાહ



# પ્રાતઃકાળે બારણું ખખડાવનાર કેણું હતું?!

શ્રી અને શરણાગતિપૂર્વક એ વ્યક્તિ શક્તિ-ઉપાસના-ગાયત્રી ઉપાસના આદરે છે, તેના આધિ-વ્યાધિ-ઉપાધિ સહિત સર્વ કણો તો દૂર થાય જ છે, પણ પૃથ્વી પર તેના અસ્તિત્વની, તેના સ્વદ્ધમ ઉપરિથિતની, તેની અસીમ ને અમર્યાદ શક્તિ ને તેની સર્વજ્ઞતાની અનુભૂતિએ તેના શરણાગતને કરાવે છે, એમા સ્વી-પુરુષનો કોઈ લેદ રહેતો નથી. સ્વી ને પુરુષ પરમાત્માનાં જ સર્જનો છે -ખાળો છે. એટલે એમા કોઈ લેદાવ રહેતો નથી.

અતે પ્રતુહ કરેલો પ્રસંગ આ જ હકીકતની પ્રતીતિ કરાવે છે.

ગાંધીનગરથી કૈલાસ કે. છાયા લખી જણ્ણાવે છે:

તા. ૨૨-૩-'૮૪

ગાંધીનગર

"અમારા સંસારઝી બાગને જીવનજળથી સિંચન કરી હરિયાળો બનાવનાર પરમ પૂજય શુરુહેવ, ગાંધીનગરથી આપની શિષ્યાના લાખો-કોટિ-કોટિ વંદન. પૂજય શુરુજ ! આપતો 'આ' સ્વહૃપ છે. અમારી સર્વ હકીકત જણો છો છતાં અમારા હર્ષ ખાતર, મા અણીની પણ કેવી રીતે સહાય કરે છે, તે આપની જાણ ખાતર અમારા માદગાર પ્રસંગો લખી જણ્ણાવું છું.

૧. મને ધણી વખત ખૂબ જ ખાંસી થઈ જતી. સીંગદાણા, કોપરું કંઈ જ ખવાય નહિ. ડોક્ટરની દવા ચાલુ હોવા છતાં ફેર પડે નહિ. આપની સુલાક્ષણથી હું ગાયત્રી-જ્યોતિ હતી. તેથી મને એકાએક જીવનજળનો વિચાર આવ્યો. હું આપની પાસે આવી. ખાસીની વાત કરી. આપના દર્શન કરી જીવનજળ ચાલુ કર્યું ત્યારપણી ખાંસી બિલકુલ જતી રહી.

૨. એક વખત સૌબજનો સમય હતો. મારે મારા પતિહેવ સાથે સ્કુટર પર બદાર જવાનું થયુ. સ્કુટર પર એસતા પહેલો એકાએક યાદ આવતો હું ગાયત્રી મહામંત્ર ઓલીને એડી. અમારા સ્કુટરનું ગવર્નર વાંકું હતું અને પાછળની સીટ હાલતી હતી. હ્યેક મિનિટ સ્કુટર ચાલ્યુ. મારા પતિહેવ મને હાલ્યા વગર જ ગવર્નર સીધું કરવા ગયા ને હું સ્કુટર પરથી હાઈવે રોડ પર ગાયડી પડી ને જો થી જણ શુલાંટ ખાઈ ગઈ. હું એકદમ જોની થઈ ગઈ. આગળ કે પાછળ કોઈ વાહન આવતું ન હતું ! મને હંથે તેમ જ પગે નજીવી ધ્રુજ થઈ હતી. માણે મને બચાવી લીધી હતી. તેથી મને ધણો આનંદ હતો.

૩. મારા પતિહેવ એ વર્ષથી પરદેશ છે, અમે એ બહેનો એક ધરમાં પરણેલા છીએ તેથી હાલ હું બહેન-ખનેવી સાથે રહું છું.

અધાર મહિનો હતો. મેં અને મારા બહેને અતુંડાન કરવાનો વિચાર કર્યો હતો. અમે વર્ષની ચારે નવરાત્રી અતુંડાન કરીએ છીએ. રાતના એકાએક પવન, વીજળી સાથે વરસાદ આવ્યો. વાતાવરણ હંડું બની ગયુ. સુનાં પહેલા વિચાર કર્યો કે એલાર્મ મૂકીને સુઈ જઈ એ છાએ પરંતુ માતાજીની હંડિશ હંશો, અને સવારે ચાર વાગે ઉડાશે તો અતુંડાન કરીશું. નહિ તો નહિ કરીએ.

રાતના અમે બધા સુઈ ગયા. સવારના પોણુાચાર વાગે અમારું બારણું એકદમ જોરથી કો'ક ખખડાવવા લાગ્યુ. મને એમ કે બીજી રૂમા મારી બાણીએ સુઈ ગઈ છે તે વાચવા મારે જિડી

આધ્યાત્મિક કેડી, જાન્યુઆરી, '૮૪ ]

હશે. તથી મેં કહું કે જિબા રહો, હું જોલું છું. થોડીવાર પણી દૂરી જોતે જ આપાજી મેં એકદમ જીણે બારણું જોલ્યું તો કોઈ ના હેખાય. ખીજુ એ ઇમારી દૂરી આવી પણ કોઈ હેખાય નહિ! આવે જીણે બધાને પૂછ્યું તો બધા કહે, ‘અમે તો સુર્જ ગયા હતા. અમને તો કંઈજ જ બાબર નથી! અને બારણું પણ ઘરની અંદરનું જેથી બહારથી કોઈ અખડાવી શકે તેમ ન હતું. અમે બધા જુદી થઈ ગયા! સાક્ષાતું ‘આ’એ સવારના અનુષ્ઠાનનો સમય થયો એટલે ઉઠાડયા.

૪. માતાજીની કૃપાથી તેમ જ આપના આશીર્વાદથી મારે મારી એ બાળકો સાથે પરહેલું જવાનું થયું. પરહેલું જવાનો તો ખૂબ આનંદ તેમ જ ઉત્સાહ હતો. પરંતુ પહેલી વખત જવાનું હોયાથી જ્યારે પણ એલેનને જેઓ ત્યારે મનમારી ખૂબ જ ચિંતા અને બધું પેઢા થતા હતા કે હું કોઈ રીતે જઈશ? અમારું એલેન રાતના નવ વાગ્યાનું હતું. અને પહેલી વખત એલેનમારી જેસવાનું હતું. અને બાળકો સાથે એકલાં જવાનું હતું. મેં માતાજીને ખૂબ જ વિનંતિ કરી કે મા તમે તો ખૂબ વાગ્ય છો. મને હિંમત તેમ જ શક્તિ આપો. ‘આ’એ મારી અરજી સાબણી. અને ત્યાં મહિના પરહેલા રહીને પાછી પણ એકલાં જ આવ્યા. અત્યારે મને જ્યાલ પણ નથી આવતો કે હું હોય રીતે ગઈ અને કોઈ રીતે પાછી આવી! માઝે મને ખૂબ જ શક્તિ આપી હતી. ત્યાં પણ મારે જીવનજળ પીવાનું ચાલુ જ હતું. ત્યાંથી આવ્યા પછી જીવનજળ ખલાસ થઈ ગયું. મને મનમારી જરા વિચાર આવ્યો કે હવે મારી તમિયત સારી રહે છે, તથી જીવનજળ બંધ કરી દૂં.

મા જાણે છે કે જીવનજળની જરૂર છે છતી બંધ કરે છે. તથી જ્યારે જીવનજળ નહોનું ત્યારે અને એકાએક કોઈ દિવસ પણ નથી થયો. તેવો માથામારી દુઃખાવો થવા લાગ્યો. માયું ગુમ રહેવા લાગ્યું, હું કંઈ જાઉં છું, શું જોલું છું, શું કરું છું, તેનો કોઈ જ્યાલ ન આવે. મને થયું કે ને આમ ચોડા દિવસ રહેશે તો હું પાગલ થઈ જઈશ, હું ધણી વખત માયું પકડીને જેસી રહેતી તથી મારા પહેલે કંબું કે આપણે મગજના ડોક્ટરને બતાવીએ. મને ‘આ’ પર પૂરો વિશ્વાસ હતો. તથી મેં કંબું કે હમણું નહિ. એકવાર આપણે અમદાવાદ જઈ ગુરુજીના દર્શન કરી આવીએ અને જીવનજળ લઈ આવીએ. ત્યાર પછી બતાવીશું. તથી અમે બંને પહેલો આપની પાસે આવ્યા. મેં માથાના દર્શની વાત કરી. જીવનજળ લીધું. કીર્તિ નિયમિત જીવનજળ શરૂ કર્યું. આપના દર્શન કરીને નીકળ્યા પછી તરત જ દુઃખાવો ધીમે ધીમે એછો થતો હોય તેમ મને લાગ્યું. અત્યારે મારું ખવું દુઃખ જરું રહ્યું છે. ડોક્ટરને બતાવવાની જરૂર પડી નહિ.

આપના આશીર્વાદથી તેમ જ માતાજીની કૃપાથી અમારી દરેક કામ સફળ થાય છે. મા તો દુઃખ જ દ્વારા જુદું છે. અંતર્યામી છે. દરેકના મનતી વાત જાણે છે. માને યાદ કરવાથી, મંત્રનામ કરવાથી દરેકનું દુઃખ દૂર થાય છે. માતાજીની કૃપાથી અશક્ય વરતુ પણ શક્ય થઈ જાય છે! મા ને કરે છે દરેકનું દુઃખ દૂર થાય છે. માતાજીની કૃપાથી અશક્ય વરતુ પણ શક્ય થઈ જાય છે! માને મનમારી થાય તે સારું જ કરે છે. ધણી વખત એવા જનાવ અને છે, કે આપણને દુઃખ થાય છે અને મનમારી થાય છે કે આ જોલું થઈ રહ્યું છે, પરંતુ પાછળથી થાય છે કે મા ને કરે છે તે સારા મારે જ કરે છે. મા કરી કોઈનું જોલું કરતી નથી.


ઉપરોક્ત ખખી વિગતો માતાજીની કૃપાથી તેમ જ આપના આશીર્વાદ તેમ જ આપના દર્શનથી બની છે! આપ તો માસ્વરૂપ છો. આપ તો દરેકને આશ્વાસન આપો છો. આપ જોલે છો. તે જાણે સાક્ષાતું ‘આ’ જોલે છે. આપનો જોલ કરી નિષ્ઠળ જતો નથી. આપનો હસમુખો ચહેરો સફા યાદ આવે છે.”

‘કૈલાસ ઉર્ફે મનીખા જે. છાયા ગાધીનગર, સેક્ટર-૨૨.’



[ આધ્યાત્મિક કેરી, જાન્યુઆરી, '૮૪

## પૂજય ગુરુહેવના સાન્નિધ્યની પળોમાં....



ચૈર સર્વિબાપક છે. પ્રાણીમાત્રમાં-જીવમાત્રમાં તે રહેલો છે. જીવજન્તુ, પ્રાણીઓ અને માનવસહિત સમગ્ર સૃષ્ટિ પરમાત્માનું સર્જન છે અને પરમાત્મા તેનું નિયન્ત્રણ-સંચાલન કરતા હોય છે. તેથી આ સૃષ્ટિના જડ કે ચેતન પ્રત્યેક પદ્ધતિ પર પરમતત્વની શક્તિની આણુ પ્રવર્તે છે. મૂડ પ્રાણી જોલી નથી શકતું, તેની વેદનાને-તેની મુરકેલીને-તે મનુષ્યની જેમ વાચા નથી આપી શકતું ત્યારે તેની અકળામણુ અનેક ગણી વધી જાય છે. તે અકળામણુને વ્યક્ત કરવા તે વિશિષ્ટ અવાજ કરે છે, ઉછાળા મારે છે, કૂદકા મારે છે અને ઉચ્ચ દિંસકતાની દૃઢ સુધી તેના ઉછાળા-કૂદકા વધતા જાય છે ને કોઈ માનવી-તેનો પાલક સુદ્ધાં તેની નજીક જવાની દિનમત નથી કરી શકતો.

આવી વેળાએ તેની નજીક જઈને તેના શરીર પર અને આજુઆજુના વાતાવરણુમાં પરમતત્વની શક્તિની આદોલનો પ્રસરાવવામાં, તેનો સંરપદ્ધ કરાવવામાં આવે તો જરૂર તેની પેલી મૂડ વેદના ને અકળામણુ શમી જાય ને તે સ્વરથ ને શાંત બની જાય !

એક વાર એક બહેતે પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે, ‘ગુરુહેવ તેમ જ માતાજીના સમરણ, આરીવાઈ અને કૃપાથી એક ગાય દૂધ આપતી બંધ થઈ ગઈ હતી તે દૂધ આપતી થઈ ગઈ.’ આથી ગાય જેવા સૂક્ત ને પવિત્ર ગણ્યાતા પ્રાણી પર માતાજીએ કેવી કૃપા કરી તે જાણવાના કુતૂહલ્યથી તેમને વાગતે વાત કરવા કહ્યું. તેમણે એ પ્રસંગ વર્ણવતાં જાણ્યાયું હૈ,

“મારી પાસે માતાજીની પાદુકા છે. પાદુકા પર દરરોજ ગાયના જ દૂધનો અલિષેક તેમ જ ગાયનું જ દૂધ માતાજીને ધરાવવાનો મારો નિયમ છે. ગામમાં એક જ જણને વેર ગાય છે. તેમની પાસે હું દરરોજ દૂધ મંગાવું છું. એક દિવસ તેમણે દૂધ ન આપ્યું. તે દિવસે મારાથી ગાયના દૂધનો અલિષેક ન થયો. તેમ જ માતાજીને દૂધ ધરાવાયું પણ નહિ. મનમાં ખૂબ જ વસવસો-જ્વાનિ થયા, ખોજે દિવસે-ત્રીજે દિવસે પણ તેમણે મને ગાયનું દૂધ આપ્યું નહિ. આથી મેં શક્ય ને સુલભ હતું તે રીતે અલિષેક કર્યા ને નૈવેદ્ય ધરાવ્યું. છતાં મારા મનનો વસવસો વધતો જતો હતો. ત્રીજે દિવસે સાંજે હું બળરમાં નીકળા ને ચાલતાં ચાલતાં જ કોઈક અગોચર પ્રેરણથી હું દૂધવાળા બાઈને ત્યા જવા પ્રેરાઈ અને ગઈ. જઈને મારાથી ઉચ્ચ સાહે, જણે કોઈક અંદરથી જોલાવતું હોય તેમ, પૂછાઈ ગયું, ‘કેમ લાઈ, શું છે? આજ તણું તણું દિવસથી તમે ગાયનું દૂધ નથી આપતા?’ તેમણે કહ્યું: ‘શું કરું બહેન, ગાય દૂધ જ દોહવા નથી હેતી. હું એની નજીક જાઉં છું ને ગાય દૂધવા ને ઉછળવા લાગે છે ને શાંગડું મારવા આવે છે. મારી ગાય કોઈ દિવસ આમ નહોતી કરતી. આજ કેમ આમ કરે છે, કોઈની નજર-ટોક લાગી છે કે શું તે સમજાતું નથી...’ મારા ઉચ્ચ અવાજથી આજુખાજુના લોડા લેગાં થઈ ગયા હતી. પળભર તો હું યે વિચારમાં પડી ગઈ. હુરી પાછો કોઈક અગોચર પ્રેરણનો અંદરથી જાયકારો થતાં મેં ગુરુહેવ તેમ જ માતાજીને યાદ કર્યાં. મંત્ર જપવા માડ્યા ને હું ગાય પાસે પહોંચી ગઈ. ને અનોઅન પ્રાર્થના કરવા લાગી કે, ‘હે મા-ગુરુહેવ, ગાયને દૂધ હો. હે મા-ગુરુહેવ, ગાયને દૂધ હો.’ એમ જોલતાં જોલતાં મેં ગાયને શરીરે હાથ ફેરવવા માડ્યો. જેતાં જોતામાં તો માન્યામાં ન આવે તેમ ગુરુહેવના ને માતાજીના સમરણ-પ્રાર્થના-જપનો કોઈ જાહુ થયો. હોય તેમ ગાય લેશમાત્ર ભડકી નહિ, ઉછળા નહિ ને ઝૂઢી નહિ, તેમ જ તેણે શાંગડું પણ ઉગામ્યું નહિ. કોઈક અગોચર શક્તિથી જ મારાથી જોલાઈ ગયું કે, ‘લાઈ, હવે તમારી ગાય દૂધ દોહવા હેશે. હવે ગાય તોઢાન નહિ કરે. અને મારી એક વિનંતી છે કે ગાય જેવું દૂધ આપે કે તરત પહેલું નિયમ મુજબ વેર આપી જગ્યે અને પછી તમારે ખોજે જાયાં આપવું હોય ત્યા આપણે.’ પછી ગાયે ખૂબ જ શાંતિથી દૂધ દોહવા દીધું. તે લાઈ ગાય દોહીને આપો તાસળો. લરીને દૂધ લઈ ને વેર આવ્યા ને મારો આલાર માનવા લાગ્યા. એટલે મેં કહ્યું ‘આલાર મારા મા-ગુરુહેવનો! તેમનામાં અપાર સત (શક્તિ) છે!’ મેં તો તેમની પાસેથી મારી જરૂરિયાત મુજબનું દૂધ લીધું. તેમણે આપો તાંસળો આપતી કહ્યું, ‘બહેન, બહું જ દૂધ તમે રાખી લ્યો!’ પણ ના, મારે તો માત્ર માતાજીની પાદુકાના અલિષેક ને નૈવેદ્ય મારે જરૂર હોય તેઠલું જ જોઈએ. મારે વધારે દૂધનું કામ નથી. અને તેણો બાકીનું દૂધ લઈ વેર ગયા. ગુરુહેવની ને માતાજીની કૃપાથી હું ખૂબ ગદગદિત થઈ, વન્દી રહી.

“એ જ રીતે અમે એકવાર બહુ મોટા અકરમાતમાંથી ભિગરી ગયેલા. એક વાર વાકાનેર પાસે આડેશર, હું ને મારા પતિ સાથે ગયલા. સાંજે પાછાં ફરતાં ધોખમાર વરસાદ વરસી રથો હતો. વરસાદ ને ઉચ્ચ સ્વર્ણે વરસતો હતો. તે જોઈ મેં મારા પતિને કહ્યું કે આપણે રાત અહીં જ રોકાઈ જરૂર એ, પણ તેણો માન્યા નહિ. અમારી સાથે ઘણ્યા બધા અન્ય માણસો પણ હતા. અમે બધા અસર્માં બેઠા. છતાં મારી છંદળ તો છેવટ સુધી રાત રોકાઈ જવાની હતી. પણ એ માન્યા નહિ એટલે અમે બ

हार्दिक निमंत्रण

शुभ विवाह

॥ श्री गणेशाय नमः ॥



कुयात् सदा मंगलम् ।

॥ श्री गणेशाय नमः ॥



मंगल अवसर



पूज्य गुरुहेवना सुपुत्र

चि. योगेशकुमार ना

शुभ लक्ष्म

ता. २२-१-'८४ ने रविवार, पौष वद पांचम

५

: मांगलिक प्रसंगो :

वरधोडा : ता. २२-१-'८४ रविवार, सवारे १०-१५ क्लाउ

हस्तमेणाप : खपोरे १२-१५ क्लाउ

आ प्रसंगे योजेल भोजन समारंभमां खपोरे १२-३० क्लाउ उपस्थित रहेशो.

: मांगलिक प्रसंगो तथा भोजननुः स्थान :

स्वाभीनारायण मंदिरनी वाडी, स्टेशन पासे, भिण्ठनगर,

अमरावाई - ३८० ००८



## શુભ-લગ્ન

છલકાયો આસવ વેદજનની કૃપાનો,  
આવ્યો આંગળે અવસર,  
બારળે લહેરાયાં લીલાંછમ તોરળો,  
ગુંજ ને ટહૂકી જિઠયાં,  
શરણાઈના સૂર

ન

ઉદ્ગ્રહેષ સપ્તપદીના મંગલસૂત્રાનો.  
સંચરી રહ્યાં છે

## ચિ. યોગોશી - ભાગ્યાંજા

દામપત્ર કેરા પ્રસ્થાને,  
ને સ્વર્ગેથી વરસી રહેશે  
પૂજય ખાપુલાલના અમિયલ આશિષ!  
આ મંગલ ટાણાએ ઉપરિથિત રહેશો.

તા. ૨૨ મી જન્યુઆરી .....

નરેન્દ્રભાઈ હવે (શાલીલ)

અ. સૌ. કુસુમબાહેન હવે

ગ. સ્વ. પરસનબાહેન હવે



१०८ राजवाहनरथ यज्ञोदय  
वीर्ये उपासने प्रवेशन ॥

બસમા એઠા. અસ ચાનુ થઈ. હાઈ-વે પર ચારેકાર દોર અંધારું હતું ને વરસાદ ઘોંઘમાર અવિરણ વરસી રહ્યો હતો. ડ્રાઇવર, સાવધાનીપૂર્વક બસ હંકારી રહ્યો હતો. રસ્તા પર પાણી કરી વળ્યા હતાં. વરચે ગરનાણું હતું. તે પણ કંઈક તૂટી ગયેલું ને પાણી ભરાયા હોઈ વરચે આવતા ખાડાઓનો પણ રવાલાવિડપણે જ ખ્યાલ ન આવે. તેથી ગરનાણા માસેથી પસાર થતી અસ પાણી ભરેલા એક કાંડા ખાડામાં અડધી જેટલી જાંધી વળી ગઈ. અને સૌ ગલરાયા. હવે શું કરવું ? બહારનું પાણી તેમ જ વરસાદની જેરહાર વાળું એ બસમાં પણ આવવા લાગ્યા. તેથી હવે શું કરવું ? ને મેં અમે સૌએ રમરણ ચાલુ કરી દીધું. મંત્ર જ્યપવા માડુંચા. મનોમન હું પ્રાર્થના કરવા લાગી કે હે મા-ગુરુદેવ, અચાવે. તેમ જ બહાર કાઢો, મદદ કરો વગેરે. હું ડ્રાઇવરની પાછળી સીટ પર જ એઠી હતી. હું બધું જેતી હતી. ડ્રાઇવર બસને ખાડામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આજુખાજુ દોર અંધકાર હતો. બહાર રસ્તા પર આજુખાં જીસેલો. માણુસ પણ જોઈ ન શકાય ને વરસાદને કારણે તેનો અવાજ પણ ન સંલગ્નાય, ત્યા જ અચાનક ડ્રાઇવરની કુભિનનું બારણું એલી કાળા કપડાંવાળો, ગુરુદેવના જેવા સ્વરૂપનો એક માણુસ અંદર ચડ્યો ને ડ્રાઇવરની પાસે તેને ખસેડીને એસી ગયો. તે ડ્રાઇવરનો ખભો થાયડી કહે કે, હિમત રાખ ચિન્તા કરીશ નહિ. હું હંહું તેમ બસ હંક. તે માણુસ ડ્રાઇવરનો ખભો થાયડો. જાય ને કહેતો જાય કે ગલરાધીશ નહિ. આમ કહેતો કહેતો તે ડ્રાઇવરને બસ હંકારવા સૂચન કરતો. જાય કે બસ આમ લે, હવે આમ વાળ, એમ ડ્રાઇવરને દોરવતો. જાય. એમ કરીને તેણે નજુકના બસ રટેન્ડ સુધી ડ્રાઇવરને સૂચનાઓ આપી, બસ હંકારાવી અને રટેન્ડ નજુક આંધું એટલે અધવચ્ચે બસને જિલ્લી રખાવી ને ડ્રાઇવરને કહે, બસ, હવે બસ અહીં જ જિલ્લી રાખ. મારે તો અહીં જ જિતરી જવું છે ને તમે બધા હવે ચાલતા ચાલતા ગામમાં પહોંચી જાવ. પણ પેલો માણુસ જિતરીને કયા ને કયારે અદરથ થઈ ગયો. તે દેખાયું નહિ. હું બરાબર ડ્રાઇવરની સીટની પાછળ એઠી એઠી બધું જ જેતી હતી, પણ કાઈ જ ખાર ન પડી ! ”

\*

\*

\*

બહેન શ્રી લગવતીબહેન તેમનો એક અનુભવ વર્ણિતાં જણાવે છે. ‘પૂ. ગુરુદેવ, લન્ડન ગયા તેના થોડાક દિવસ અગાઉ મારા દીકરાને શરીરે કોઢ કૂઠી નીકળ્યો. હું તેને લઈ ને ગુરુદેવ પાસે ગઈ. બતાંધુ. ગુરુદેવ જેણું. જીવનજળ આંધું, સૂચનો કર્યાં અને માતાજીનું રમરણ-ઘ્રણ ચાલુ કર્યું. આમેય દરરોજ જ્ય કરવાનો અમારા ધરના બધાનો નિયમ છે જ પણ તેમાં વધારો કર્યો. ત્યાર બાદ ગુરુદેવ લન્ડન ગયા. મારા દીકરાના જ્ય-જીવનજળ વગેરે ચાલુ જ હતું. પૂ. ગુરુદેવના લન્ડન નિવાસ દરમ્યાન કોઢ ધીમે ધીમે અદરથ થવા લાગ્યો. ગુરુદેવ લન્ડનથી આંધ્યા પછી હું મારા દીકરાને લઈ ને કુઠું ને ગઈ. ગુરુદેવે સમાચાર પૂછ્યા. મેં બતાંધુ અને કંદું કે, પહેલાં કરતો હવે ધણું સારું છે. ગુરુદેવ એ જોઈ-નાણીને ધણું જ ખુશ થયા. અને તેમણે કંદું કે આ સારું થવું ખૂબ જ દુષ્કર કાર્ય હતું. પણ ચાલો સારું થઈ ગયું તે સારું થયું. માતાજીની કૃપા થઈ ગઈ ! પણ તેમ છતી વિશેષ તો તમારી અદ્ધા ને શરણાગતિ જ એટલાં બળવતાર છે કે જેતે કારણે આ દુષ્કર કાર્ય સારી ને સરળ અની ગયું ।

મેં કંદું કે, ગુરુદેવ, આ કેવળ આપની જ કૃપા અને આપની આત્મિક-માતાજીની શક્તિથી સારું થયું છે. અદ્ધા અને શરણાગતિ અમારી નથી, એ પણ કેવળ આપની જ કૃપા અને શક્તિથી આધ્યાત્મિક કેડી, જાંધુખારી, '૮૪ ]

ઉદ્ભવી છે. એ કેવળ આપના આર્થિવીંનું જ ઇન છે. એમને આમ શક્તાને શરણ્યાગતિને વહું ને વહું બજવતર બનાવતો રહેશો અને આશિષ-કૃપા વરસાવતા રહેશો એ જ પ્રાર્થના કરું છું.”

\*

\*

\*

નિદોષા પર પૂજય ગુરુદેવની વ્યક્તિગત મુલાકાત માટે આવતી બાઈબેનો, વડીલો, વગેરે બધાં કંઈક ને કંઈક વિવિધ પ્રશ્નોથી મૂંજાતી હોય છે. એમાંના કેટલાક સામાન્ય પ્રશ્નો કદાચ આપણુંને પણ મૂંજરતા હોય છે.

પૂજય ગુરુદેવ કહે, “થોડા દિવસ પર એક બહેન મળવા આવ્યા. અતિ મૂંજાયેલાં અને પરેશાન લાગતો હતાં. કહે, ગુરુદેવ, મારે કોઈ સાથે લેણું જ નથી. બીજાં માટે, આડોશી-પાડોશી, સગાંસંબંધી, બધાં માટે હું ધસાડું છું, છતાં ભારા માટે કોઈ કામમાં આવતું નથી. બીજોઓ સાથે મારે સંબંધો ટકતા જ નથી. હું ગમે તે રરતો અજમાવું પરંતુ બહું જ વ્યર્થ જય છે. થોડા વખત સરખું ચાલે, વળી પાછું એ વેરવિભેર થઈ જય છે.

ગુરુદેવ, માણુસો સાથે સારા જીવનંધો ટકાવી રાખવાનો સારો રરતો મને બતાવશો. મારી ભૂલ થતી હોય તો તેમાં પણ આપ યોગ્ય માર્ગદર્શન આપશો.

બહેન, રરતા તો ધણા છે, પણ આપણે કી તો એ બરાબર જાણુતા નથી હોતા, ને જાણુતા હોઈએ તો યોગ્ય રીતે અમલમાં મુક્તા નથી. ધણી વાર પાયાની ભૂલ એ થઈ જય છે કે સારા સંબંધો કેળવવા ઉપર આપણે એટલો બધો ભાર મૂકીએ છીએ કે સામા માણુસને એ વજનનો જ્યાલ આવવા માડે છે અને થોડા વખતમાં એ ભારમાંથી હળવો થવા દૂર ભાગે છે. એટલા માટે કરોચાય ભાર રાખ્યા વગર કે આપ્યા વગર સારા સંબંધો કેળવવા અને ટકાવી રાખવા એ એક કળા છે. માનવસંબંધોના કેટલાક મૂળભૂત મનોવૈજ્ઞાનિક નિયમો છે. એમને જો બરાબર સમજુને ઉપયોગમાં લેવાય તો સફળતા મળે જ.

આ જગત પડ્યા અને પ્રતિબિંદોની એક અનંત હારમાળા છે, એક વ્યક્તિના મનમાં કંઠાળો, ધૂષ્ણા, વિઝાર વગેરે ભરેલાં હોય તો જગત તેને કંઠાળામય અને વિઝારભર્યું લાગે અને સાચી વ્યક્તિ તરફથી તેને એવો જ પ્રતિબાવ મળવાનો.

જેના અંતરમાં પ્રેમ અને સમભાવ ભરેલાં છે તેને સર્વત્ર પ્રેમ અને સમભાવનાં જ દર્શાન થવાના. આ સાવ સાહો નિયમ છે. દુનિયા આ નિયમને આધારે જ ચાલે છે.

આપણી ધણી છચ્છા છે કે આ બ્રાહ્માચારી સમાજ, બ્રાહ્માચારી દુનિયાને બદલી નાખું, તેને સાત્ત્વિક અને સુંદર બનાવી દઉં. પરંતુ એ શક્તય કયારે બને? આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ હું એટલા સાત્ત્વિક સુંદર બનવાની ક્ષમતા આપણું માંને? કોનો ઉપયોગ આપણે કર્યો છે? આ જીવનને સાત્ત્વિક અને સુંદર બનાવવા આપણે શું કર્યું? જગત લલે ન બદલાય આપણે આપણી જાતને તો બદલવાનો પ્રયાસ કરીએ!

સામા માણુસ ઉપર આપણો કેવો પ્રલાવ પડશે એની આપણુને વધારે પડી હોય છે, એનાથી તમને શું મળવાનું? અહમુ પોષવા સિવાય આપણે એમાંથી કોઈ જ મેળવી શકતા નથી. ક્ષણવાર પ્રલાવ પાડીને કોઈ ને ચકિત કરીને પણ આપણુને શો લાલ થવાનો?

સામા ભાષુસને મળીએ ત્યારે સારા હેખાવાની ને પ્રલાવ પાડવાની વાત જ સાવ ભૂલી જવી. ખીજ ભાષુસોને ભૂલી જઈને પોતાની જત સાથે કામ શરૂ કરીએ, પોતાના પદ ઉભેળાને સમજવાનો પ્રયત્ન કરીએ, સામા ભાષુસનો સારો અભિપ્રાય મેળવવાનો કોઈ ભાર રાખ્યા વગર આપણે આપણું પોતાનું કાર્ય નિષ્ઠાથી કરે રાખવું, જે કહેવાનું તે સરળ શાખામાં કઢી દેવું, વિનય જળવવો, વિવેક અનવું પરંતુ સામા ભાષુસને ખુશ કરવા પોતાની જત સાથે અપ્રમાણિક તો કચારેય ન અનવું.

આમા નાનમ, મોટાઈ, સ્વાર્થ કે એવું કોઈ જ નથી. પોતાની જતને, પોતાના સત્ત્વને, સત્ત્વને શૈધવા માટેનો આ પ્રમાણિક પ્રયત્ન છે, સાચો રહ્તો છે. પોતાની જત માટે સહભાવ કેળવવાથી જ આપણે ચારે તરફ સુંદર સહભાવનાની સૌરલ સર્જ શકીશું.

જાતસમજથું જેવી અધરી અને ઉપયોગી ખાખત બીજુ કોઈ નથી.”



ડ. નં. Office : ૩૪૫૩૬  
Resi. : ૨૭૫૬૬



## કાંતિલાલ છોટાલાલ જરીવાલા

દ્વેક જાતનો ખરાનો કસાચ તથા ઈભીટેશન કસાચ બનાવનાર તથા વેથનાર  
૪/૩૩૮, બેગમપુરા, દુખારાશેરી, સુરત - ૧



Always use our Famous Gold & Imitation Threds.



VASANT BRAND  
VASANTLAL & BROTHERS  
SURESH FAMILY TRUST

8/1912 Gopipura Sanghadiavad, Opp. Dawdji's Lane,  
SURAT - 395001

## શાસ્ત્રીય જ્ઞાન

**પ્રશ્ન :** પૂર્ણ ગુરુહેવ, નવરાત્રિમાં કે કોઈ એવા ધાર્મિક પ્રસંગે કોઈ બહેનાને ભાતા આવે છે, ભૂઈ આવે છે, ધૂષ્પવા લાગે છે, કંકુ-ચૂંદી આવે છે, માતાજી સવાલ-જવાબ કરે છે. આ બધું શું સાચું છે? વળી બહેનાને જ મોટેલાગે માતાજી આવતી હોય છે.

**ઉત્તર :** ઉપાસકને-અક્તાને દ્વિત્ય શક્તિના પ્રત્યક્ષ કે પરોક્ષ દર્શન થાય કે પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરીનો અનુભવ થાય, આહલાદક સુવાસમય વાતાવરણ સર્જય એ એક હકીકત છે. સ્વામી રામતીર્થ, મારી, નરસિંહ મહેતા, શ્રુત, પ્રશ્નલાલ અને એવા ડેટલાય ભક્તો છે જેઓને પરમાત્માની પરમ શક્તિના વિવિધપે પ્રત્યક્ષ કે પરોક્ષ દર્શન થયાં છે અને આપત્તિમાં સહાય કરી છે.

પરંતુ કોઈને શરીરમાં ભાતા આવે કે ભૂઈ આવે તે વરતુ સત્ય નથી. ધૂષ્પવું, ચમત્કારો સર્જવા આ બધું હૈવી લક્ષણો નથી. માનસિક વિકૃતિનું આ પરિણામ છે.

મહાન મનોવૈજ્ઞાનિક ઝોડિનું વિધાન છે કે માનવી એ જરૂરિયાં જરૂરિયાં પ્રાણી છે. તેની મૂળભૂત જરૂરિયાતોને સમજવામાં આવે તો જ તેને સમજવું સરળ બની શકે.

માનવીની ત્રણ મૂળભૂત પાયાની જરૂરિયાતો છે:

(૧) પ્રેમ-હૃદ્દ, (૨) મહારવ-પ્રશાંસા અને (૩) સલામતી.

આમાની એકાદ જરૂરિયાત પણ ન સંતોષાય તો પણ માણુસ માનસિક વિકૃતિમાં ધસડાઈ જાય છે. આપણ્યા સમાજમાં અમુક વર્ગની બહેનાને ઉપરોક્ત જરૂરિયાતો ન સંતોષાવાને કારણે ભાતાજીના કે હૈવી શક્તિના ઓઠા હેઠળ ઉપરોક્ત જરૂરિયાતની પૂર્તિ માટે આ પ્રમાણેનું પોતાનું મહારવ પ્રથાપિત કરવાનો પ્રયત્ન કરે છે.

**પ્રશ્ન :** ગુરુહેવ, મારે ભાતાજીનાં દર્શન કરવા છે. આપ મને રસ્તો હેખાડશો? એક ઉપાસક ભાઈએ અતિ નભ્રતાથી ગુરુહેવને વિનંતી કરી.

**ઉત્તર :** યથાયોગ્ય સમયે આપને પણ ભાતાજીનાં દર્શન થશે એમ કંઈ ગુરુહેવે પુરાણો એક પ્રસંગ વર્ણિયો.

એક મુનિએ અહ્લાજીની પાસે જઈને પૂછ્યું, “મારે પરમાત્માના દર્શન કરવા છે આપ રસ્તો હેખાડશો?”

અહ્લાજીએ કહ્યું - ત્યાગ કરવા માંડો.

મુનિ કહે - શાનો ત્યાગ કરું?

અહ્લા કહે - જે તમારી પાસે હોય તેનો.

તમારી પાસે શું છે? ધન વૈલખનો ત્યાગ? પુત્રપુત્રાદિ, કુદુંબ, ગૃહત્યાગ? ભૌતિક જગતનો ત્યાગ કરી સંન્યાસી થઈ જાઓ? પરમાત્માને પામવા માટે ત્યાગ કરવાનો છે આતરિક શત્રુઓનો. આત્માને કલુષિત કરતાં આવરણો કામ, કોધ, લોલ, મોહ, ધર્ષણા, ચોરી, પરનિંદા, વિશ્વાસઘાત, વગેર આવરણો. દૂર થાય એઠલે નિર્મણ આત્મા-પરમાત્માને પામી શકે છે. અરે ખુદ પરમાત્મા આવા નિર્મણ વિશુદ્ધ આત્માઓને સ્વયમ્ભ અપનાવે છે.

**પ્રશ્ન :** ગુરુદેવ, વિશ્વમાં આ બધા ધર્મો પ્રવર્તત છે તો કયો ધર્મ સારો, કયો ધર્મ અપનાવવો, તેમાં મૂંજાઈ જવાય છે.

**ઉત્તર :** ભાઈ, ધર્મનો અર્થ જે આપણે અત્યારે સમજુએ છીએ તે સંપ્રદાયો છે. તેને ધર્મનું કહેવાય. ધર્મ એક જ છે. ધાર્મિકતા એક જ છે. આપણું જુદા જુદા સંપ્રદાયોભાં જે કંઈ તફાવત હેખાય છે તે ઉપરછલ્લા છે. જે જિંડાખુમાં જોઈએ તો બધા સંપ્રદાયોભાં સમાનતા જ વ્યાપક હોય છે.

આપણે જે ખરેખરા ધાર્મિક હોઈએ તો આખી ભાનવળતને, પોતપોતાની માન્યતાઓને, અતુસરવાનો અધિકાર છે એમ જરૂર સ્વીકારવું જોઈએ. આપણે આખ્યકાન બંધ કરીને એસી રૂબે ન પાલવે. સંપ્રદાયોની વિવિધતા અને માન્યતાઓની અનંતતાને કારણે આ જગત કેવું રંગલયું ને રળિયામણું લાગે છે એનો વિચાર પણ કરવા જેવો છે, એક ભાષુસના મનમાં એક સુંદર વિચાર આવે તે એને લાગે કે ભગવાનને ભજવાનો એક બીજો રસ્તો પણ છે ને પોતે એ રસ્તો જાહેર કરે તો જગતને વળી એક નવી ઉપાસનાપદ્ધતિ મળે.

વિશ્વમાં જેટલા નવા ધર્મ ઉલા થયા તેના મૂળમાં આવા કોઈ સત્યનું દર્શાન જ કારણુભૂત છે. ધન્યતાની પળમાં કોઈની સામેથી સત્યના પાત્ર ઉપરનું સોનાઢાંડણું ખૂલ્લી જથ્ય ને એને સનાતન તેજનું દર્શાન થાય તો એના મનમાં એ સહભાવના જગવાની જ કે જે અમૃત મને પ્રાપ્ત થયું એ અન્યને પણ મળો. “હિરણ્યમયેન પાત્રેણ...” વાળો ઉપનિષદ્ધનો શ્લોક જેના અંતરમાથી જાગે એની સામે સત્યનો પ્રકાશ પ્રગટ્યા વગર રહેતો નથી.

“તમસો મા જ્યોતિર્ગમય...ની પ્રાર્થના જવાબ વગર રહેતી નથી.” “ઉંમ સહનાવવરસુ...” માં સાથે મળોને જીવન જીવવાની જે પ્રાર્થના છે એનો અર્થ પણ એજ થાય છે કે માનવી એક સામુદ્દરિક પ્રાણી છે. સમૂહયારી જીવ છે ને એને પોતાના પાથેય વહેંચીને આવાં ગમે છે. પ્રત્યેક નવા સ્થપાતા ધર્મ અને સંપ્રદાયના મૂળમાં આ સહભાવના અનિવાર્ય પણ રહેલી હોય છે.

તુતન ધર્મના આ જ્યોતિર્ધરાને નવો પ્રકાશ કરેલો રીતે પ્રાપ્ત થયો એને વિષે આપણે પરોક્ષ રીતે જાણીએ છીએ. એકાદ વસ્ત્રિણું કે વિશ્વાભિત્રને કે તેમનાથીય અગાઉના વૈદિક ઋષિઓને એ મંત્રના પ્રકાશદ્દેખે હેખાતો. અશો જરયુસ્ત અને મહંમદ પથંગથર જેવાને એનું એલાન થતું. કેટલા સંતોને અંતરમાં પ્રેરણું થતી.

મારા મતે ધર્મ એટલે કોઈ મંહિરમાં જરૂર ને અક્તિ કરવી, વિધિવિધાન પ્રમાણે વર્તવું, વિગેરમાં જ સીભિત નથી. ધર્મ આધુનિક ઇપ ધારણું કરીને વ્યક્તિના જીવનમાં જી'ડા જિતરી શકે છે ને તેને જીવંતતાથી રસી શકે છે. તેને નવજીવન બદ્ધી શકે છે.

ધર્મને જીવનવિમુખ બનાવીને એક ઉત્તમ તંત્રના લાભથી વંચિત રહીને પોતાની જતને આપણે કેદિલું બધું તુકસાન પહોંચાડણું છે તેનો વિચાર કરવા જેવો છે. આજે નહિ તો કાલે; પ્રાચીન ભારતીય સંરક્ષિતના અને અધ્યાત્મના આદ્યાને આપણે અમલમાં મૂકવો જ પડશો, ધર્મને જીવનાલિમુખ અનાવવો જ પડશો.



# આદ્રમંગુજા : ૧

ડૉ. કાન્તિલાલ કાલાણી

**મનને સત્તમાર્ગ વાળવા શું કરવું ?**

ચાચું હોય તેનો ખંચકાટ વિના સ્વીકાર કરવો અને અસત્યની આગપંપાળ ન કરવી.

સંસારમાં કોઈ પ્રત્યે રાગદ્રોષ ન રાખવા. જૌ પોતપોતાને સ્થાને બરાબર છે.

સમવૃત્તિ ફેળવી જવવું. એટલે ન આસક્તિ રાખવી, ન ધિક્કાર.

આચરણ પ્રત્યે સાવધ રહેવું. આચરણ જેઠલું ઉચ્ચ અને પવિત્ર તેઠલું જવન સુગ-ધમય.

ભગવાનને કન્દ્રમાં રાખ્યા જવવું.

**કોઈ વસ્તુને પ્રાપ્ત કરવી હોય તો પ્રથમ શું કરવું ?**

વસ્તુની ખરેખર ઉપયોગિતા કટલી છે તે બરાબર વિચારી લેવું. ઉપયોગિતા સમજતા તેની પ્રાપ્તિ માટે દદ સંકલ્પ કરી કામે લાગી જવું.

**કેનો સંગ કરવો ?** અનુભવી વ્યક્તિઓનો - તત્ત્વદર્શી સાધુજ્ઞનોનો.

**જીવનમાંથી ખાલી કરવા જેવું શું ?** ધ્યાનાંશો - તૃણાંશો.

**જીવનમાંથી શું ઘુલ્લું પડી જાય તો સારું ?** કરેલા દોષો.

**જીવનમાં શું દંકાયેલું રહે તે ધિષ્ટ ?** ગુણ - શુલ્ક કર્મ.

**જીવનમાં શેનાથી દૂર રહેવા જેવું છે ?** કુસંગથી - પાખ-દથી, અધર્મ, અનીતિ, અસત્યથી.

**જીવનમાં હાંસલ કરવા જેવું શું ?** નિર્ભયતા.

**કર્મધાર્થનમાંથી કેવી રીતે મુક્ત થવાય ?**

ઇણની અપેક્ષા કે ઇણ પ્રત્યે આસક્તિ રાખ્યા વિના કર્મ કરવું.

કર્તાપણુનો ભાવ રાખ્યા વિના સર્વના હિત માટે કર્મ કરવું.

મન, વાણી અને કર્મમાં પ્રલુની સ્થાપના કરવી, કર્મના ઇણ ભગવાનને અર્પણ કરતા જવા.

**શાંતિનો અનુભવ શેમાં થાય છે ?**

પોતાપણુનો ભાવ છોડવામાં, ત્યાગમાં, સરળતામાં સ્વીકારવામાં.

**શાચ્ચા પ્રેમ કેને કહેવો ?**

જ્યાં સર્વપણુનો ભાવ છે. જ્યાં કોઈ ગણુતરી નથી, સ્વાર્થની ગન્ધ નથી.

જ્યાં વધ-ધટ બડ-ઉત્તર નથી, આશાંકા કે અવિશ્વાસ નથી, ઊર કે કપટ નથી, ધર્માં કે દંબ નથી.

**જહેલાધી તરી જવું હોય તો શું કરવું ?**

માનસિક બોણરહિત બની જવું.

આસક્તિ અને પરિઅન્ધના પોટલાં બાળુ પર મૂકી ઢેવાં.

હુદ્ધર કયાં વસે છે? નિશ્ચયમા, સન્તોના હુદ્ધમા.

સન્ત કાને કહેવાય?

ને સુખ-દુઃખ, લાભ-દાનિ, નિન્દા-સ્તુતિ, હર્ષ-શોક, માન-અપમાન, ગમો-અધ્યગમો, રાગ-દ્રોષ,  
વજેરે દન્દોથી પર છે.

નેમનામા વાસના, વિચાર કે વેરબાવ નથી.

ને ગુણુયાણી છે, સમલાવી છે, અનાસક્તા છે, નિર્ભય છે, સરળ છે, ક્ષમાશીલ અને સન્તોષી છે.

ને નિર્મણ અને વિવેક છે અને જેનો પરમાત્મા પ્રત્યે આઠળ ગ્રેમ છે.

ખાણા ઓરાક કર્યા? લગવદ્દુ-રમરણ અને સેવા.

સંસારનું વિશેષ લક્ષ્ય કર્યું?

વિચિત્રતા અને વૈવિધ્ય

જેમા ઊંડા જિતરવાથી સારતત્ત્વ હાથમાં આવતું નથી.

કોનાથી છેટા આલખું? અસત્થી.

જેનું હુદ્ધ મલિન છે, ને સ્વાર્થને ડેન્ડમા રાખે છે, લોલી અને કંનુસ છે તેનાથી.

મનુષ્યત્વ કયારે ભીદી ઉઠે? સ્વાર્થરહિત સેવાથી.

સાધુ સમાગમ માટે કઈ તૈયારી કરવી? વ્યક્તિભાવ છોડવાની.

કાળજીપૂર્વક શું સાચવશું? વર્તમાનકાળ.

કર્યું આચરણ એઠા? કપટરહિત આચરણ અથવા નિર્દેષભાવે થયેલું આચરણ.

માનસિક તાણમાંથી ઘયવાનો ઉપાય કર્યા? પરિસ્થિતિનો સમજપૂર્વક રવીકાર.

સાચું પ્રાયસ્થિત કર્યું?

થયેલી ભૂલ ફરી ન થાય તે.

અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો ક્ષમા માગવી અને મન-છન્દિયો પ્રત્યે ઝૂણા ન રહેવું.  
કર્યું મલિન તૃપ્તિદાયક?

સ્વાર્થરહિત મનુષ્યયત્ન અને પ્રભુકૃપાનું મલિન.

કાળની કોના પર અભીદિષ્ટ રહે છે?

સમયનો ઉત્તમ રીતે સદૃષ્યોગ કરનાર પર.

હુદ્ધને કોણ ટાંક આપી શકે?

નિર્મણ ગ્રેમ.



‘ગુરુકૃપા ડિ કેવલમ’

મીના ટ્રેડસ

“લગવતી”



ઉદ્વાડા-Rs. ૩૬૬૧૮૫

## આધ્યાત્મિક કેરી : પુરશ્વરાગુના ભીતરમાં

**૩૮**

તમા પ્રકરણમાં મંત્રજ્ઞપ કરતો હતુમાનજી અને સહજાનંદ સ્વામીનાં દર્શન થતો. એક અગ્રૂદ એવું સ્વેન જેણું. સ્વર્ણમાં માટલા ઉપર સત્ય, અહિંસા અને પ્રેમ એવા વિલિન શબ્દો હતા ને ખીંડી જુદા તરી આવતા માટલા ઉપર લખેલું હતુ કે, ગુરુભાવ રાખ, તારું અહૃતું ઋષુ દીઠી જરો. ત્યાર બાદ ગુરુદેવ પાસે જતા ગુરુદેવ સન્તોષ વ્યક્ત કર્યો હોય તેમ લાગ્યું. તેમણે પ્રેતસાહન ને આર્ગદર્શન આપ્યા.

હવે આગળ આઠમું પ્રકરણ વાંચો.

\*

\*

\*

### ૮ : જીવનજળનો પ્રભાવ

**૩૯**

ચાનક રસક્ષતિ થઈ. ફરી પાછાં વાઢો ધેરાયા. સુખદ અનુભૂતિઓ કર્યાંક લખાઈ ગઈ. અસ્વરસ્થતાએ આવીને આસન જમાવ્યું.

મારી પત્ની અનસ્યા માંદી પડી. અઠવાડિયે એકવાર ટાઠ વાઈને તાવ આવતો, આખમાંથી પાણી ટપક્યા કરતું. ખીંડ-તીંડ દ્વિસે વળી સારું પણ થઈ જતું. તેથી તખીણી ઉપચાર અજમાવ્યા નહિ. પરન્તુ આ કુમ દીર્ઘકાલ પર્યાન્ત ચાલ્યો. એક દ્વિસ તો ખૂબ તાવ આવ્યો. આંખે અંધારાં આવવા લાગ્યા. ગાયત્રી માતાનાં દર્શન થયા. અમે પૂ. શ્રી શાખ્વીજીના દર્શને જવાની તૈયારી કરી. રીક્ષા કરીને થોડેક રસે ગયા અને આંખે હેખાતું અંધ થઈ ગયું. જણે દષ્ટિ અન્ધકારમય બની ગઈ. શરીરમાં કંપન સાથે પંચમુખી મા ગાયત્રીનું સ્વહૃપત્ર સ્પષ્ટપણે ઉપસી આવતું. સાથે સાથે શારીરિક પીડા પણ વધતી જતી હતી. પૂ. શાખ્વીજીના અંગલાના દરવાને પહોંચતાં સુધીમાં ચક્કર આવી ગયા. ચાલીને અંદર જવા જેટલી પણ શક્તિ ન રહી. માંડ માંડ એને પકડીને પૂ. શાખ્વીજીના ઓરડામાં એમની સમીપ પહોંચ્યા. આ હકીકત પણ શાખ્વીજ સમક્ષ સુપેરે રજૂ કરી શકાતી નહોંતી. આખમાંથી પાણી વલે જ જતા હતા. છેવટે તો મારી યે ધીરજ ખૂટી ગઈ. આખમાં આસુઓ ખસી આવ્યા. દૂમો લરાઈ આવ્યો. માંડ માંડ શાખ્વીજ સમક્ષ અમારી મુશ્કેલી રજૂ કરી.

પૂ. શાખ્વીજએ શક્તિપ્રદાનની સારવાર આપી ને અભિમંત્રિત જળનો છંટકાવ કર્યો. એ છંટકાવ થતાની સાથે જ પીડાની માત્રામાં કમથાઃ ધટાડો થતો ગયો. એ સમય દરમ્યાન પણ અનસ્યાને મા ગાયત્રીનાં દર્શન તો ચાલુ જ હતા. પૂ. શાખ્વીજએ આખાસન આપી કહ્યું કે, ‘ડરશો નહિ, જીવનજળ ચાલુ રાખજો! તેમને ત્યાથી નીકળો ધેર આવતાં સુધીમાં તો લગભગ સારું થઈ ગયું હતું.

થોડા દ્વિસ પછી ફરી પાછો અનસ્યાને તાવ આવ્યો. ફંડી લાગવા મારી. ડોક્ટરને ઘતાવ્યું. ડોક્ટર લોહી, પિશાખની તપાસ કરાવવા જણાવ્યું. એના નિધાનમાં ડાયાખીટીસના રોગની પ્રતીતિ થઈ. ડાયાખીટીસ વધુ પ્રમાણમાં હતો. દવા-ચરીમાં નિયમિતતા રાખવાની આવશ્યકતા હતી.

અમે ફરી પૂ. શાખ્વીજ પાસે ગયા. ડાયાખીટીસની વાત કરી. હરહંમેશની તેમની રીત પ્રમાણે તેમણે જીવનજળ નિયમિત ચાલુ રાખવા કહ્યું. તેમ જ રોગ અંગે અન્ય સૂચનો પણ જણાવ્યો ને તેનો અમલ કરવા કહ્યું.

— ને અમારા સૌના આશ્રમ વચ્ચે એક જ મહિનામાં ડાયાખીટીસમાંથી સમ્પૂર્ણપણે મુક્તિ મળો. પૂ. શાખ્વીજીના જીવનજળના સેવન બાદ મુનઃ તખીણી સલાહ લીધી. તખીણોએ ફરી પરીક્ષણ કર્યું,

પણ કોઈ રીતે ડાયાખીટીસની એક ભાત્રા સરખી પણ ન જણાઈ! તખીએ પણ આશ્ર્યચક્ષિત થઈ ગયા, કારણ ડાયાખીટીસનું જેર વધુ પ્રમાણમાં હતું. તખીએ સાથે બોરાક તેમ જ અન્ય ઉપચાર અંગે વાત કરી. વળી તખીએએ એમ પણ જણાવ્યું કે જેને આ રોગ લાગુ પડે છે તે ફીને કાયમ માટે દ્વા-દ્વાર્જેક્શન લેવા પડતાં હોય છે. પણ આ તો ખૂબ દૂંક સમયમાં સારું થઈ ગયું. જે કે અમને તો આ વાતની ખખર જ નહોતી!

સાચે જ માની કૃપા ને પૂ. શાસ્ત્રીજીના આરીષનું એ સુધૂળ છે!

તદુપરાંત અનસ્યાએ લીમડા-કળિયાતનો રસ ને શાસ્ત્રીજીના જીવનજળનું સતત સેવન કર્યા કર્યું ને એ સાચા અર્થમાં નૂતન જીવન પ્રદાન કરનાર જળ બની રહ્યું!

શ્રદ્ધાપૂર્વકની મા ગાયત્રીની ઉપાસના જ એની પડે કારણભૂત બની ને!

મા ગાયત્રી ને ગાયત્રી-મહામંત્રની ઉપાસના દ્વારા માના સંકેત-આદેશ મુજબ પૂ. શાસ્ત્રીજી સંતોષ માનવીને ગાયત્રી-અલિમુખ કરી, જીવલેણુ-અસાધ્ય એવા રોગ માટે જીવનજળ ને શક્તિપ્રદાનની સારવાર આપી તેમને નવજીવન બક્સે છે ને એમ દીન હુંથી માનવખંડુઓની સુશ્રુષાનો બેખ એમણે ધારણ કર્યો છે. ગાયત્રીનો પ્રચાર-પ્રસાર કર્યો છે, અનાદિકાળથી ચાલી આવેલી ને લુચ્ચત પામેલી ગાયત્રી-ઉપાસનાની પુન. પ્રતિધૂતાનું અમૃત્ય કાર્ય કર્યું છે, ને કર્યે જય છે. દરેક વ્યક્તિને તેઓ વ્યક્તિગત મુલાકાત આપી ગાયત્રી અંગે માર્ગદર્શન આપે છે પરન્તુ તેઓ કોઈપણ વ્યક્તિ પાસેથી કોઈપણ પ્રકારની હી કે દાન-દક્ષિણા રવીકારતા નથી. નિષ્ઠામલાવે મા ગાયત્રીની ઉપાસના કરતા જય છે, નિઃસ્વાર્થ ભાવે માનવખંડુઓની સેવા ભાત્ર કરવાની એમની નેમ છે. કોઈપણ પ્રકારની કીર્તિ-યક્ષણી એમને કોઈ લાલસા નથી. મા ગાયત્રી પ્રત્યે શ્રદ્ધાન્વિત બની એની ધર્માચા મુજબ કાર્ય કર્યે જય છે-એની સંક્ષિપ્તતા-નિષ્ઠિતતાનો તેઓ વિચાર કરતા નથી. મા ગાયત્રીની ઉપાસના દ્વારા એમને જે શક્તિ સમ્પ્રાપ્ત થઈ છે, એનો લોકહલ્યાણુને માર્ગ વિનિયોગ કરી માનવકલ્યાણું એક ઉમદા ને ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મા ગાયત્રી એમને વધુ ને વધુ શક્તિ પ્રદાન કરતાં રહે, વધુ ને વધુ લોકો એનો લાલ ઉઠાવતા રહે એવી અભ્યર્થના સહિત પૂ. શુરુદેવ શ્રી શાસ્ત્રીજીને કોટિ કોટિ પ્રણામ!

\*

\*

\*

જીવન કે ઉપાસનાના દૈનિક કે ચોક્કસ આયોજનપૂર્વકના કભમાં આ ને આવી અનેક શારીરિક-માનસિક સંકુષ્ઠિતતાઓ આવીને વિક્ષેપણ બની રહે છે, ત્યારે કોઈક સંત, સિદ્ધપુરુષ, શુરુનાં સલાહ-સૂચનો જ ઉપકારક બની રહે. તે સિવાય પામર મનુષ્યને પામર મનુષ્યની સૂચનો-સલાહનો કોઈ ખાસ અર્થ નહિ સરે. એથે જ સંતનો-ગુરુનો અનન્ત મહિમા ગવાયો છે ને તે દરેક વ્યક્તિને સ્વાનુભવે જ સમજશે. □

Tele. Address : Trishul Jari

Phone : 29707, 29395

Natvarlal Motiram Jariwala  
Sadhna Trading Co.

&

Sashikant Natvarlal Jariwala

7/4325, Opp. Galemardi Gate, SURAT - 395003

## પૈસા પાછા મહુયા !

વડોદરાથી એક ભાઈ તેમનો સ્વત્નુલવ વર્ષાવતો લગ્ની જણુંને છે;  
પરમ પૂજય શ્રી ગુરુહેલ,

જગતજનની ગાયત્રી માતાની દ્યા અને આપના જેવા સહગુરુહેવના આશીર્વાદ અને ગાયત્રી મહામંત્રની પ્રચંડ શક્તિના પ્રભાવથી મારી મોટી ચિંતા દૂર થઈ છે. માતાજીની દ્યા અને આપના આશીર્વાદની શક્તિનો મને અનુભવ થયો છે, તે વર્ષાવવાના મારી પાસે શાખ્યો નથી.

તા. ૧૬ મી મે, ૧૯૮૧ ના રોજ જમીન આપીને મકાન બાંધી આપવા માટે મેં એક ભાઈને હા. ૧૦,૦૦૦ આપેલા. તેનું કોઈ માં કરારનામું પણ કરેલ. પણ ત્યાર પછી એકાદ-મે મહિનામાં જ મને ખખર પડી ડે આ તો ગુંચવણુલરેલ છે અને જમીનનો મૂળ માલિક કોઈક કારણુસર પેલા બાધીને દસ્તાવેજ કરી આપતા નહોંતા. તે વગર મને પણ જમીન કયાથી આપશે! અને મને મકાન કયાથી બાંધી આપશે? આ હકીકતો મારા જણુંવામાં આવ્યા પછી છેલ્લા કેટલાક મહિનાઓથી મારા મન ઉપર ચિંતાનો એક બોંને જણે ડે તોળાઈ રહ્યો હતો. જ્યારે જ્યારે મને આ વાત યાદ આવે ત્યારે ત્યારે જણે અંતર કંકળી જિંતુ હતું અને પ્રારકો પડતો હતો. મેં મારા ગ્રોવિંડ ઇંડમાંથી ૧૦,૦૦૦ હા. ઉપાડેલા હતા. તે કો તો મારે પોતાનું મકાન બનાવવામાં વાપરવા હતા અથવા તો મારી દીકરીના લઘે પ્રસંગે કામ આવશે તેમ કરીને મેં ઉપાડેલા, જે આ રીતે સલવાઈ જતો હું બહુ જ ચિંતામાં હતો.

આમ તો હું છેલ્લા ન્રણુંક વર્ષથી ગાયત્રી માતાની ભક્તિ કરું છું. અને મારી તેમજ મારા કુદુંબીજનોની શારીરિક તકલીફ હોય તો હું વારંવાર આપની પાસે બાળકની માઝક હોડી આવું છું અને તે બધી તકલીફો માતાજીની દ્યાથી અને આપના આશીર્વાદથી દૂર થયેલ છે. પરંતુ આર્થિક મુશ્કેલી અને આટવી મોટી રકમ (મારા માટે તે ધણી મોટી રકમ કહેવાય) સલવાઈ જતો મને ધાર્યું જ દુઃખ થતું હતું. છેલ્લા પન્દરેક દિવસથી અંતરમાંથી સ્કુરણ્યા થતી અને આપને આ વાત કહેવાની ધર્યા થઈ, પણ મનમાં થતું ડે આ લૌતિક પ્રશ્ન છે અને ગુરુહેવને ડેવી રીતે કહું. એમને બહુ દુઃખ થશે, પણ ચિંતા અને દુઃખ અને તેને લીધે ગાયત્રી માતાની ભક્તિમાં અને જપમાં પડતી મુશ્કેલીઓનો વિચાર કરીને હિંમત કરીને હું આપની પાસે તા. ૧૦-૧૧-'૮૧ના રોજ મુલાકાત માટે આવ્યો. મેં આપને વાત કરી ડે, એક જગ્યાએ મારા ૧૦,૦૦૦ હા. સલવાઈ ગયા છે અને મારા માટે તે એક બહુ મોટો ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે આપે મને એટલું જ કહેલું ડે 'સાઉ', હું કરીશ, બસ, જાઓ', અને મારા મનોનો એક બોંને જણે ડે હળવો થઈ ગયો! એ પહેલાની મુલાકાતોના દૂંકો વાક્યો, એમાં રહેલી શક્તિ અને સત્ય થવાની સિદ્ધિની મને યાદ આવી. જેમ જેમ એ યાદ મને આવી તેમ તેમ નવી જ શક્ષા ઉત્પન્ન થએ. જ્યા કરવામાં મને વધુ એકાગ્રતા અને આપનાં આછા આછા દર્શાન થવા લાગ્યા. તેથી મારામાં વધુ હિંમત આવી. અને હા. ૧૦,૦૦૦ ની બધી ચિંતાઓનો ભાર જણે ડે માતાજીના અરજોના મૂડી દીધો. રોજની પ્રાર્થના પણ કરતો હતો. બાળક લાવે વધુ શક્ષાથી જ્યા કરવા લાગ્યો. જ્યારે જ્યારે ૧૦,૦૦૦ હા. ની ચિંતા થવા લાગતી ત્યારે ત્યારે આપનાં વચ્ચેનો યાદ આવતાં. મને થતું ડે, પુ. ગુરુહેવના શાખ્યો હંમેશા સાચા પુરવાર થયેલા જ છે. ગુરુહેવ બોલે છે એ ગાયત્રી માતા જ બોલે છે. એટલે ગાયત્રી માતાની દ્યા, ગુરુહેવના આશીર્વાદ અને ગાયત્રી મહામંત્રની પ્રચંડ શક્તિથી મને જરૂર મારા પૈસા પાછા મળશે જ.

ત્યાર પછી ૧૫-૨૦ દિવસ પછી સાક્ષીમાં રહેલ ભાઈ મને મળવા આવ્યા અને કહે કે, વ્યાજ સાથે પૈસા જોઈતા હોય તો બાર મહિના પૂરા થવા હો અને વ્યાજ વિના જોઈતા હોય તો પેલા ભાઈએ એક અઠવાડિયામાં પૈસા આપવાનું કહ્યું છે. આ બનાવથી મારામાં શક્ષા વધ્યા. હું વારંવાર આપનું ને માતું નામ લેતો હતો. અને ચિંતા ભૂલી જતો હતો.

મને જથ્યાવતી ધણો આનંદ થાય છે કે, તા. ૨૫-૧૨-૮૧ના રોજ હું જ્યા કરતો હતો ત્યારે આછા આછા આપના દર્શન થયાં. આપને દૂર ભાગેલા જોયા અને આપના દાથમાં જે પરશુ છે તે બને હાથેથી આપે પકડેલું હતું. ત્યાર પછી માતાજીના દર્શનનો જાંખે ભાસ થયો. એમના દાથમાં પણ પરશુ જેયું અને ગુરુદેવ, મને લાગ્યું કે આજે માતાજીની દ્વારા અને ગુરુદેવના આશીર્વાદથી કંઈક અલૌકિક અનુભવ થશે અને તે જ દિવસે રાત્રે મને મારા ૧૦,૦૦૦ રૂ. પાછા મળ્યા ગયા! મારા જીવનમાં મને પહેલી વખત લાગ્યું કે ગાયત્રી માતાની દ્વારા તથા આપના જેવા મહાન સહગુરુદેવના આશીર્વાદ અને મહામંત્રની પ્રચંડ શક્તિની હૃદાનું અને સહારો મને પણ મળ્યો. આપના આશીર્વાદ, માતાની દ્વારા અને મહામંત્રની શક્તિ વિશેના દાખના મારા અંતરના ભાવેને વણ્ણવા મારી પાસે શાખ્યો નથી.

આપના ચરણોમાં બસ્તક મૂકીને લાખ લાખ વન્દન કરું છું. આપના આશીર્વાદથી મારી શક્ષા, શક્તિ અને એકાગ્રતામાં વહું ને વહું દટ્ટતા આવે અને મનની ભલિનતા દૂર થાય એવી આશા રાખું છું.

લિ. આપનો ખાગડ  
ગજનન કરોડ



શુલેચ્છા સહિત :

Res. : ૩૬૫૦૫  
Fact. : ૩૭૦૦૪

ડૉ. જ્યંત વાડીલાલ ગીલીટવાલા

દરેક જાતનો જરી કસણ ગીલીટ કરનાર



ડૉક્ટર જ્યંત કેશ્વરી  
એન્ઝ્યુગ્ન જ્યોતોટ બનાવનાર

: ઇકટરી :

ઘોટ નં. ૧૩/૧, અદોદરા  
ઉધનારોડ

: રહેઠાણ :

૬/૫૬૮ કાટસફિલ રોડ,  
સુરત-૧

# કાંઈ પ્રસાદ

**મુલી** ગાયત્રીની શરણુગતિ લઈને પૂરુષુદેવના સાનિધ્યમાં માર્ગદર્શન માર્ગ આવનાર લગભગ પ્રત્યેક ઉપાસક કંઈક ને કંઈક વિરલ અનુભવના, માતાજીના કૃપાપ્રસાદના અધિકારી બનતા રહે છે. લાઈ શ્રી સતીશભાઈ કાંઈપ્રસાદના અધિકારી બન્યા છે. પૂરુષુદેવ પત્રિકાન્યિત માર્ગદર્શન આપે છે, અને એઓ પોતે જે કંઈક અનુભવે છે, જુએ છે, તેમાંથી એક નવો જ અર્ક લઈને તેમની કવિતા રચાય છે-અવિરત રચાતી રહી છે. તેમના પોતીકા ભાવવિશ્વાના વિનિયોગ સહિત અને તેમાંથી થોડીક પંક્તિઓ પ્રસ્તુત કરીએ છીએ.

— સ. પાઠ્ક

છીએ હાથ ને હોડે તો, હવે હૈયે વસાવી લો,  
મળે એ માત કચારે તો, કહી થાડું મનાવી લો.  
વધ્યા છે યુગ પણું આજા, ઘડી તો આવશે ત્યારે,  
તમે તો હેતથી ખુદ પ્રેમની ગંગા વહાવી લો.

સદપુરુષોનું સાનિધ્ય કંઈક પુણ્યોનો ઉદ્દ્ય થાય લારે જ મળે છે. પૂરુષું મિલન પ્રાપ્ત થતા પણ હુદ્ધ કંઈક તરેહતરેહના લાવો અનુભવે છે. સેંકડો મનુષ્યો પાસેથી માતાજીની કૃપાપ્રસાદીના પ્રસંગો જોવા-જાણવા મળે છે લારે પળેપળે મા ગાયત્રી પ્રત્યે અહોભાવ પ્રગટ થયા કરે છે. કેટલીક વાર મનોમન એલી જવાય છે કે આપનું મિલન અમને અખ્યુત તો છે, તો હવે આપ અમને આપના અન્તરથી અળગા ના કરશો. મા ગાયત્રીને પણ મનાવીને કંઈક વાત કરો કે તે પણ અમારા તરફ અમીદાદ કરે. યુગોથી રાહ જોઈ રહ્યો છું-હવે તે શુભ ઘડી કચારે આવશે? આપ અમને પ્રાપ્ત થયા છો તો આપ જ આપના પ્રેમની ગંગા વહાવીને અમને પવિત્ર કરો. અમને લાયક બનાવો. અમને તેની કૃપા પ્રાપ્ત થાય તેવા પાત્ર બનાવો.

હુદ્ધયના લાવનો કંઈ લેખ લઈ નીકળી પડો,  
કંઈક કારમા ખુદ કૂલ કચારીની તરફ દોરી જશો.

દરવાન-કાઈનું અરિતત્વ સ્વીકાર્યાં વગર, તેની હાજરીની સક્રિય નોંધ લીધા વગર, કૂલના સુરોભિત મહેલમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ છે. જગતમાં આંધ્યા છીએ, તો જગતની જે કંઈક હકીકતો છે તેનો સ્વીકાર કર્યા વગર, તેની હાજરીનો અનુભવ કર્યા વગર તેમાંથી બહાર નીકળી જવું દુષ્કર છે. સન્તો જગતમાં જ આવે છે, પરન્તુ તેઓ સલાન હોય છે, તેમના હુદ્ધયનો બેખ 'તેની' સાથેનો જ હોય છે, અદે ને તેઓ રહે છે, જીવે છે આપણું જેમ. એક મનુષ્ય તરીકે જ્યારે આપણે જગત સાથે જ એકતાન રહીએ છીએ. હું એટલે જગત-આ એકલો જ ભાવ આપણું માં સતત જગૃત રહે છે. અને તેથી જ તેમાંથી જે કંઈક ઉત્પન્ન થાય છે-મીઠાશ કે ઠડવાશ તે કેવળ આપણો જ અનુભવ બની રહે છે. સાચી વાસ્તવિકતા આ નથી. નીચેની પંક્તિ કંઈ જય છે કે હુદ્ધયના સર્પૂર્ણ ભાવથી તેના પ્રતિ કદમ ભાડવાં શરૂ કરી દો તો કૂલની સુગંધનો જ અનુભવ કાયમ રહેશે. કાઈનો ડંખ અરેરાદી પ્રસારી નહિ શકે-સંસારની સમસ્યાઓ કાઈ વિપરીત અસરો નિપાલવી નહીં શકે.

— સતીશભાઈ ભાઈ

[ આધ્યાત્મિક દેશ, જાન્યુઆરી, '૮૩

# સમાચાર

- તा. ૨૨-૧-'૮૪ ને રવિવાર, પૂજય શુરૂહેવના સુપુત્ર ચિ. ચોગેશકુમારના શુભલક્ષ્મ.
- 'આધ્યાત્મિક કેડી' ટૈમાસિક અંકનું વાર્ષિક લવાજમ ડિસેન્બરમાં પૂરું થયું છે.  
આગામી ૧૯૮૫ ના વર્ષ માટે આપણું લવાજમ રીન્યુ કરાવી લેશો.  
પાંચ વર્ષનું સામદું લવાજમ લરી શકાશો.

|           | વાર્ષિક લવાજમ     | પાંચ વર્ષનું બેગું |
|-----------|-------------------|--------------------|
| ભારત      | ૧૦ ઇન્દ્રિયા      | ૫૦ ઝા.             |
| અમેરિકા   | ૫ ડોલર્સ          | ૨૫ ડોલર્સ          |
| ઇંગ્લેન્ડ | ૪ પૌંડ-સ્ટલ્ડીંગ. | ૧૬ પૌંડ            |

- પૂજય શુરૂહેવનાં પુસ્તકો ગુજરાતી-અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ થયાં છે. અમદાવાદમાંથી  
કુલુમાં મૈળવી શકાશો :

(૧) ઉપાસનાનો રાજમાર્ગ (૨) અગોચરના ઊંડાણમાં (૩) True Worship



પૂ. શુરૂહેવના આશીર્વાદની અભ્યર્થના સહિત



આરતી ટ્રેડસ್

જનરલ મરચન્ટ

'ભગવતી'

ઉદ્ઘાડા - Rs. ૩૬૧૧૮૫

મા ગાયત્રીની કૃપા અને

પૂ. શુરૂહેવના આશીર્વ હરઠમેશ

વર્ષસ્તા રહે એવી નાર વિનંતી સહ

જમનાદાસ નાગરદાસ મેઢી


જનરલ મરચન્ટ

'ભગવતી'

ઉદ્ઘાડા - Rs. ૩૬૧૧૮૫, (ડિ. વલસાડ)



[આધ્યાત્મિક કેડી, જાન્યુઆરી, '૮૪ ]



અમર ગાયત્રી - ઉપાસક પુ. શ્રી શાલ્વીજ

## પૂજય ગુરુહેવની મુલાકાત

\* આધિ, વ્યાધિ, ઉપાધિથી પ્રસ્ત કોઈપણ વ્યક્તિ જાતિ, જાતિ, જ્ઞાનપ્રદાય કે ધર્મનાં અન્ધને। સિવાય વિનામૂહ્યે પૂજય ગુરુહેવની મુલાકાત લઈ માર્ગદર્શન મેળવી શકે છે. પ્રત્યક્ષ મુલાકાત શક્ય ન બને તો પણ પૂજય ગુરુહેવના આદેશ અનુસાર ગાયત્રી મહામંત્રની તથું માળાને જીવનના અનિવાર્ય ફૈનિક કાર્યક્રમમાં વધી લેને.

મુલાકાત સ્થળ : ‘નીલોષા’ બાંગલો,

ત્રિમૂર્તિં સોસાયટી, ગવર્નર્સ્‌મેન્ટ પાંચ બાંગલા પાસે,  
ગુલમાર ઇલેટ્સ પાછળ, શુદ્ધભાઈનો ટેકરે,

અમદાવાદ-૧૫.

સમય : અપોરના ૧૨-૦૦ થી ૨-૦૦ (૧૦૧ વ્યક્તિને મુલાકાત)

શનિ-રવિ તથા જાહેર રજાના દિવસે અંધ.

\* પૂજય ગુરુહેવ આપના પત્રો વાંચે છે, પરંતુ વેખિત જવાબ પાડવતા નથી.

\* શારીરિક-માનસિક રોગો માટે પૂ. ગુરુહેવ જીવનજળ આપે છે.  
સ્વચ્છ ખાલી બાટલી સાથે લાવવી, જેથી અભિમંત્રિત  
જીવનજળ આપી શકાય.

